



Jainam Jayati Shashanam!

Established in 1990

JAIN SANGH OF CHERRY HILL JAIN PANCHANG

YEAR 2020 -2021

Vir samvat 2547 • Vikram Samvat 2077

**3401 Cooper Avenue
(Corner of Cooper & Park Avenue)**

Pennsauken TWP, NJ 08109

(856) 662-1076

web: www.jainsangh.org

JAIN SANGH OF CHERRY HILL WISHES EVERY ONE HAPPY DIWALI & PROSPEROUS AND HEALTHY NEW YEAR.



For Day to Day Operation of The Jain Sangh: Please Contact (EC Committee)

Devji Dedhia	609-402-6477	Haresh Shah	302-740-9232	Ashok Vora	856-625-0381
Girish Sanghvi	215-696-2282	Bhavin Shah	215-432-4903	Bharat Doshi	856-404-0595
Dhiren Mehta	856-249-8030	Jayant Lodaya	856-534-4157	Chintan Shah	732-822-8180



॥ જૈનમ જયતિ શાસનમ ॥ ॥ સર્વજીવ કુરુ શાસન રસી ॥

**In Loving Memory of Late Dr. Vasant P. Shah & Late Jayshree V. Shah
Kunjla, Dharini, Ishan & Mihika Shah - Petlad Gujarat**



Purity to be Observed for performing Pooja

The purity of the surroundings inevitably affects one's purity of thought. Purity of the pooja ceremony of Jineshwar Bhagwaan is integral to the proper completion of Jinpooja.

Physical purity:

The aspirant should take a bath using the necessary minimum amount of water to clean his/her body.

Purity of clothes:

We should have a special set of clothes worn only for pooja. The clothing should never have been worn while using the rest room and never have been worn while eating or drinking. Traditionally, garments should be generally white and unstitched. Men are recommended to wear dhoti and khes. Women should wear appropriate clothes. We should avoid wearing black color garments when going to Derasar.

Purity of mind:

While worshipping and performing pooja kindly avoid stray thoughts. We should utter relevant verses and meditate on the virtues of the Bhagwaan.

Purity of Ground:

We should sweep the floor of the temple, clean and arrange and place the articles of worship in its proper place.

Purity of Upakaran (items used in worship):

We should buy and use the best available items for pooja and worship.
We must buy these with our own money.

Purity of Ceremony:

We should stop thinking of worldly affairs as soon as we are on our way to the temple. We should not carry out any worldly business in the temple area and should perform the Puja ceremony systematically.

How to stand in front of the Pratimaji?

While worshipping or doing darshan of the Pratimaji (Idol), men should stand on the right side and women should stand on the left side of the Pratimaji. This is also done to show courtesy in allowing others to worship and do Darshan of the Pratimaji.

Basic Steps to be followed in the temple

1st Nisihi

We should utter words 'Nisihi' (to give up) thrice first time while entering the main door of the temple. It means that I will restrain myself from engaging in worldly activities, physically, verbally and mentally. Say 'Namo Jinaanam' with folded hands while bowing the head as soon as we see Jin Murti in the temple. Then proceed to do the Darshan of the Mulnayak (Presiding Idol in the Derasar).

Pradakshina

After the Darshan of Mulnayak, we should proceed to perform three Pradakshina (circumambulation) of the Mulnayak around the Sanctum Sanctorum (Gabhaara) in the area called Bhamati, starting from the right side of the Idol. It is symbolic for acquiring virtues of right perception, right knowledge and right conduct.

Pranäm

There are three ways to do the Pranäm to Pratimaji: a) Bowing head with our both hands folded together. b) Bowing down by bending the upper part of our body half way and do Pranaam with folded hands. c) Bowing down by bringing the five limbs of the body together (two arms, two knees and the head) on the floor.

2nd Nisihi

The second time 'Nisihi' is uttered before entering the inner temple or Gabhaara. This signifies that I am abandoning the activities relating to the temple matters. I will now perform the Angpooja (pooja by touching the Idol) and Agrapooja outside the Gabhaara.

3rd Nisihi

The third time 'Nisihi' is uttered after completion of the first two kinds of Pooja also termed as Dravya Pooja or worshipping by using different materials like sandalwood, flowers, and offerings of rice, frits, sweets, etc.; and before initiating the ritual of Bhaav Pooja by doing Chaitya Vandan.

Upon exiting the Temple just outside the main door, say Avassahi thrice and recite Navkar Mantra mentally thrice.



Jai Jinendra & Best Wishes from:
Late Smt. Shardaben Ratilal Mehta, Kundan and Jayant Sheth
Komal, Vibha & Dhiren Mehta, Kundan & Jayant Sheth



DECEMBER 2020

કારતક - માગશર

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
				૧	1	૨ ❖	2	૩	3	૪ ❖	4	૫ 🙏	5
				રોહિણી								VIRTUAL SNATRA PUJA	
				કારતક વદ		કારતક વદ બીજ		કારતક વદ ત્રીજ		કારતક વદ ચોથ		કારતક વદ પાંચમ	
૬ 🙏	6	૭	7	૮	8	૯	9	૧૦ 🙏 ❖	10	૧૧ 🙏	11	૧૩	12
PHILOSOPHY CLASS								શ્રી મહાવીરસ્વામી દીક્ષા		શ્રી પદ્મપ્રભસ્વામી મોક્ષ			
શ્રી સુવિધિનાથ દીક્ષા				કારતક વદ આઠમ		કારતક વદ નોમ		કારતક વદ દસમ		કારતક વદ અગ્યારસ		કારતક વદ તેરસ	
કારતક વદ છઠ		કારતક વદ સાતમ											
૧૪	13	૩૦ ●	14	૧	15	૨ ❖	16	૩	17	૪	18	૫	19
LANGUAGE/SUTRA CLASS													
કારતક વદ ચૌદશ		કારતક વદ અમાસ		માગશર સુદ		માગશર સુદ બીજ		માગશર સુદ ત્રીજ		માગશર સુદ ચોથ		માગશર સુદ પાંચમ	
૬ ❖	20	૭	21	૮	22	૯ ❖	23	૧૦ 🙏 ❖	24	૧૧ 🙏 ❖	25	૧૨	26
PHILOSOPHY CLASS			FIRST DAY OF WINTER					શ્રી અરનાથ જન્મ		મૌન અગ્યારસ			
માગશર સુદ છઠ		માગશર સુદ સાતમ		માગશર સુદ આઠમ		માગશર સુદ નોમ		માગશર સુદ દસમ		માગશર સુદ અગ્યારસ		માગશર સુદ બારસ	
૧૩	27	૧૩	28	૧૪ 🙏	29	૧૫ 🙏 ○	30	૧ ❖	31				
			રોહિણી										
માગશર સુદ પ્ર. તેરસ		માગશર સુદ દ્વિ. તેરસ		શ્રી સંભવનાથ જન્મ		શ્રી સંભવનાથ દીક્ષા		માગશર સુદ પૂનમ		માગશર વદ			
				માગશર સુદ ચૌદશ									

MAUN AGYAARUS - FRIDAY, DECEMBER 25

મૌન અગ્યારસ - શુક્રવાર, ડિસેમ્બર ૨૫, માગશર સુદ ૧૧ - પાંચ કલ્યાણકો
શ્રી અરનાથ દીક્ષા, શ્રી મલ્લિનાથ જન્મ, શ્રી મલ્લિનાથ દીક્ષા, શ્રી મલ્લિનાથ કેવલ, શ્રી નમિનાથ કેવલ

■ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.

■ Please refrain from eating any vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

🙏 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

MONTH	SUNRISE	NAVKASHI	SUNSET
December 1 to 7	7:04am	7:52am	4:26pm
December 8 to 15	7:11am	7:59am	4:26pm
December 16 to 22	7:15am	8:03am	4:27pm
December 23 to 31	7:18am	8:06am	4:30pm

જિન મંદિરની અંદર આ આશાતનાઓ ન થાય, એની કાળજીપુર્વક તકેદારી રાખવી

- | | | |
|--------------------------------------|---|--|
| ૧. સોપારી, પાન, મુખવાસ ખાવા | ૧૮. ઘા માંથી લોહી નીકળતુ અટકાવવુ નહિ | ૪૦. અવિધિથી નિસીહિ કહ્યા વગર દેરાસરમાં જવું |
| ૨. પાણી પીવું | ૧૯. ગુમડા ચાંદા વગેરેની ચામડી ઉતારીને નાખવુ | ૪૧. મનને એકાગ્ર ન કરવુ |
| ૩. ભોજન કરવું | ૨૦. ઊલ્ટી કરવી | ૪૨. શરીરે તેલ વગેરે ચોળવું ચોપડવું |
| ૪. પગરખા પહેરવા | ૨૧. આરામ કરવો | ૪૩. ભગવંતને જોતા જ હાથ ન જોડવા |
| ૫. સ્ત્રીસેવન કરવું | ૨૨-૨૮. દાંત, આંખ, નખ, ગાલ, નાક, કાન, માથાનો | ૪૪. હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરવા |
| ૬. થૂંકવું | તથા શરીર નો મેલ નાખવો | ૪૫. લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી |
| ૭. શ્લેષ્મ ફેકવું | ૨૯. ભૂત પ્રેત કાઢવા મંત્ર સાધના કરે | ૪૬. મહેમાન વગેરેને પ્રણામ કરવા |
| ૮. પેશાબ કરવો | ૩૦. વાદ વિવાદ કરવો | ૪૭. તિરસ્કારવાળું વચન કહેવું |
| ૯. ઝાડો કરવો | ૩૧. પોતાના ઘર વેપારનાં નામાં લખવા | ૪૮. દેરાસરમાં દેવાદારને પકડવો. પૈસા કઢાવવા |
| ૧૦. જુગાર ખેલવો | ૩૨. કર અથવા ભાગની વહેચણી કરવી | ૪૯. પગ લાંબા પહોળા કરીને બેસવું |
| ૧૧. પત્તા, શતરંજ, વગેરે રમત રમવી | ૩૩. પોતાનું ધન દેરાસરમાં રાખવુ | ૫૦. પગચંપી કરવી |
| ૧૨. લડાઈ ઝગડો કરવો | ૩૪. પગ પર પગ ચડાવીને બેસવુ | ૫૧. હાથ પગ ધોવા, ઘણું પાણી ઢોળી ગંદકી કરવી |
| ૧૩. કોગળો કરવો | ૩૫. કાયદા વગેરે ના ભયથી દેરાસરમાં સંતાઈ રહેવુ | ૫૨. દેરાસરમાં પગ કે કપડાની ધૂળ ઝાટકવી |
| ૧૪. ગાળ આપવી | ૩૬. સંબંધીના મૃત્યુ સાંભળીને રડેવુ | ૫૩. શરીરના ગુપ્ત ભાગ બરાબર ઢાંક્યા વિના બેસવું |
| ૧૫. હાથ, પગ, શરીર, મોઢું વગેરે ધોવું | ૩૭. વિકથા કરવી | ૫૪. વૈદું કરવું |
| ૧૬. વાળ ઓળવા | ૩૮. પાળેલા કુતરા, બીલાડા વગેરે રાખવા | ૫૫. વેપાર લેવડ દેવડ કરવી |
| ૧૭. નખ ઉતારવા | ૩૯. પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકવી | ૫૬. દેવી દેવતાની સ્થાપના કરવી |


જિનાલય તથા જિનપૂજાનું પુણ્ય

જિનાલય જવા ઇચ્છા કરે ત્યાં એક ઉપવાસ નું ફળ મળે
જિનાલય જવા માટે ઉભો થાય ત્યારે બે ઉપવાસ નું ફળ મળે
જિનાલય જવા માટે પગ ઉપાડે ત્યારે ત્રણ ઉપવાસ નું ફળ મળે
જિનાલય જવા માટે ચાલવા માડે ત્યારે ચાર ઉપવાસ નું ફળ મળે
જિનાલય જવા માટે થોડુંક ચાલે ત્યારે પાંચ ઉપવાસ નું ફળ મળે

જિનાલય દેખાય ત્યાં એક મહિનાના ઉપવાસનું ફળ મળે
જિનાલય પહોચે ત્યાં છ મહિનાના ઉપવાસનું ફળ મળે
જિનાલયના દરવાજા પાસે પહોચે ત્યાં એક વર્ષના ઉપવાસનું ફળ મળે
પ્રભુજીની પૂજા કરતાં એક હજાર વર્ષના ઉપવાસનું ફળ મળે
પ્રભુજીની સ્તુતિ સ્તવન કરતા અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે



|| સર્વે સાધર્મિક શ્રાવકો તથા શ્રાવિકાઓને પ્રણામ જય જીનેન્દ્ર ||
Sonal, Anish, Rhea & Rohan - Rajiv, Hemali, Yashil & Layla
Dr. Ranjan Rohit Shah



JANUARY 2021

માગશર - પોષ

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT								
૩	31																				
પોષ વદ ત્રીજ						MONTH SUNRISE NAVKASHI SUNSET January 1 to 7 7:18am 8:06am 4:36pm January 8 to 15 7:18am 8:06am 4:42pm January 16 to 22 7:16am 8:04am 4:41pm January 23 to 31 7:12am 8:00am 5:00pm				૨ ❖ 1		૩ 2									
PHILOSOPHY CLASS માગશર વદ ચોથ						માગશર વદ આઠમ				૭ ❖ 7 માગશર વદ નોમ		૧૦ 🙏 8 શ્રી પાર્શ્વનાથ જન્મ માગશર વદ દસમ		૧૧ 🙏 9 શ્રી પાર્શ્વનાથ દીક્ષા માગશર વદ અગ્યારસ							
૧૨ 🙏 ❖ 10 LANGUAGE/SUTRA CLASS શ્રી ચંદ્રમલસ્વામી જન્મ માગશર વદ બારસ						૧૩ 🙏 11 શ્રી ચંદ્રમલસ્વામી દીક્ષા માગશર વદ તેરસ				૧૪ 🙏 12 શ્રી શીતલનાથ કેવલ માગશર વદ ચૌદશ				૩૦ ● 13 માગશર વદ અમાસ		૧ 14 પોષ સુદ		૨ 15 પોષ સુદ બીજ		૩ 16 પોષ સુદ ત્રીજ	
૪ 17 PHILOSOPHY CLASS પોષ સુદ ચોથ						૫ ❖ 18 MARTIN L. KING JR. DAY પોષ સુદ પાંચમ				૬ 🙏 19 શ્રી વિમલનાથ કેવલ પોષ સુદ છઠ				૭ ❖ 20 પોષ સુદ સાતમ		૮ 21 પોષ સુદ આઠમ		૯ 🙏 22 શ્રી શાંતિનાથ કેવલ પોષ સુદ નોમ		૧૦ 23 પોષ સુદ દસમ	
૧૧ 🙏 ❖ 24 LANGUAGE/SUTRA CLASS રોહિણી શ્રી અજિતનાથ કેવલ પોષ સુદ અગ્યારસ						૧૨ ❖ 25 પોષ સુદ બારસ				૧૩ 26 INDIA - REPUBLIC DAY પોષ સુદ તેરસ				૧૪ 🙏 27 શ્રી અભિનંદનસ્વામી કેવલ પોષ સુદ ચૌદશ		૧૫ 🙏 ❖ 28 શ્રી ધર્મનાથ કેવલ પોષ સુદ પૂનમ		૧ 29 પોષ વદ		૨ 30 પોષ વદ બીજ	

SHRI PARSWANATH JANMA KALYANAK - FRIDAY, JANUARY 8

શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણક - શુક્રવાર, જાન્યુઆરી ૮

- ❑ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.
- ❑ Please refrain from eating any vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

🙏 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

Misconduct (Ashaatna) to be avoided in the Derasar

- | | | | |
|-------|---|----|--|
| 1 | Eating supari & other mouth fresheners | 32 | Settling one's personal account |
| 2 | Drinking water | 33 | Storing one's wealth in the Derasar |
| 3 | Eating food | 34 | Sitting with stretched legs crossed over one another |
| 4 | Wearing footwear | 35 | Hiding from law or any government agency |
| 5 | Spitting | 36 | Crying in sorrow and mourning the death of any relative |
| 6 | Having physical relations | 37 | Gossiping |
| 7 | Coughing out phlegm | 38 | Bringing pets |
| 8 | Urinating | 39 | Occupying Derasar space for personal use |
| 9 | Defecating | 40 | Entering Derasar without proper decorum, without saying Nissih |
| 10 | Gambling | 41 | Not staying focused during prayers and while performing any rituals |
| 11 | Playing chess, cards and other games | 42 | Using body creams or lotions |
| 12 | Quarrelling and fighting | 43 | Not folding hands at the sight of the Bhagwaan's Idols |
| 13 | Gargling | 44 | Not removing any flower or garlands adorning oneself before entering |
| 14 | Using foul language | 45 | Cracking jokes |
| 15 | Washing one's face, hands, feet, etc. except before doing Puja | 46 | Greeting other attendees and devotees |
| 16 | Combing hair | 47 | Speaking harsh and hateful language |
| 17 | Clipping nails | 48 | Collecting personal debt from a debtor |
| 18 | Exposing open wounds | 49 | Sitting with legs stretched apart |
| 19 | Rubbing off dead skin from a dry wound | 50 | Getting body rub or massage |
| 20 | Vomiting | 51 | Wasting a lot of water while washing hands or feet |
| 21 | Relaxing | 52 | Brushing off dust from one's clothings |
| 22-28 | Discarding any secretion from teeth, eyes, nails, scalp, skin, ears, & nose | 53 | Not covering one's body with proper and adequate clothing |
| 29 | Performing black magic | 54 | Practicing medicine |
| 30 | Debating and arguing | 55 | Conducting personal business and offering deals |
| 31 | Writing personal or business accounts | 56 | Installing other Dev Devis |

Benefits of going to Derasar

Going to Derasar is an important deed in Jains' lives, leading to the earning of punya.

Wishing to go to Derasar = one fast (Upvaas).

Getting up to go to Derasar = two fasts (Upvaas).

Raising one's feet to go to Derasar = three fasts (Upvaas).

Walking in the direction of the Derasar = four fasts (Upvaas).

Traveling the distance to the Derasar = five fasts (Upvaas).

Sighting the Derasar = one month of fasts (Upvaas).

Reaching the the Derasar = six months of fasts (Upvaas).

Entering the Derasar = one year of fasts (Upvaas).

Performing Pooja in the Derasar = one thousand years of fasts (Upvaas).

Reciting prayers in the Derasar = infinite virtues (punya).



|| सर्वज्ञव कुरु शासन रसी ||
Jovita Detres & Hitendra G Jhaveri, Premi, Diksha, Vijay Jhaveri & Family
from Puerto Rico



કલ્યાણક આરાધના વિધિ

તપ : જ્યારે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું કરવું, બે કલ્યાણક હોય ત્યારે આયંબિલ કરવું, ત્રણ કલ્યાણક હોય ત્યારે આયંબિલ અને એકાસણું કરવું, ચાર કલ્યાણક હોય ત્યારે ઉપવાસ કરવો, પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને એકાસણું કરવું.

મતાંતરે : એક કલ્યાણકે એકાસણું, બે હોય તો નિવી, ત્રણ હોય તો પુરિમઢ આયંબિલ, ચાર હોય તો ઉપવાસ અને પાંચ હોય તો પુરિમઢ ઉપવાસ કરવો.

જાપ : ૨૦ નવકારવાળી નીચે પ્રમાણે ગણવી જે પ્રભુનું કલ્યાણક હોય તે પ્રભુનું નામ જાપના પદમાં જોડવું.

૧. ચવન કલ્યાણકે — હ્રી શ્રી.....પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણકે — હ્રી શ્રી.....અર્હતે નમઃ ૩. દીક્ષા કલ્યાણકે — હ્રી શ્રી.....નાથાય નમઃ

૪. કેવલજ્ઞાન કલ્યાણકે — હ્રી શ્રી.....સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણકે — હ્રી શ્રી.....પારગતાય નમઃ

વિધિ : ૧૨ લોગ્ગસનો કાઉસગ્ગ, ૧૨ સાથિયા અને તેની ઉપર ૧૨ ફળ અને ૧૨ નેવેધ, ૧૨ ખમાસમણા દેવાં, ખમાસમણાનો દુહો : પરમ પંચપરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમોનમો શ્રી જિનભાણ

૨૪ તીર્થકર ભગવંતોના કલ્યાણકો

કારતક			પોષ			ફાગણ			વૈશાખ			અષાઢ		
sid-Ē	71 sivi2na4	keI	sid-Ī	71 ivml na4	keI	sid-Ē	71 Arna4	Cyvn	sid-Ī	71 AiwndnSvaml		sid-Ī	71 mhavrSvaml	Cyvn
sid-ĒĒ	71 Arna4	keI	sid-N	71 xaIt na4	keI	sid-Ī	71 miLI na4	Cyvn	Cyvn			sid-Ī	71 nienna4	ma@
vid-Ī	71 sivi2na4	j Nm	sid-ĒĒ	71 Aij tna4	keI	sid-Ī	71 swvna4	Cyvn	sid-Ī	71 2mRa4	Cyvn	sid-Ē	71 vaspjJySvaml	ma@
vid-Ī	71 sivi2na4	dl9a	sid-Ē	71 AiwndnSvaml	keI	sid-ĒĒ	71 miLI na4	ma@	sid-Ī	71 AiwndnSvaml	ma@	vid-Ē	71 7gasna4	ma@
vid-ĒĒ	71 mhavrSvaml	dl9a	sid-ĒĪ	71 2mRa4	keI	sid-ĒĒ	71 minsuxSvaml	dl9a	sid-Ī	71 smitna4	j Nm	vid-Ī	71 Antna4	Cyvn
vid-ĒĒ	71 pIjpwSvaml	ma@	vid-Ī	71 pIjpwSvaml	Cyvn	vid-Ī	71 pavRa4	Cyvn	sid-N	71 smitna4	dl9a	vid-Ī	71 nimna4	j Nm
			vid-ĒĒ	71 xItI na4	j Nm	vid-Ī	71 pavRa4	keI	sid-ĒĒ	71 mhavrSvaml	keI	vid-Ī	71 k@na4	Cyvn
			vid-ĒĒ	71 xItI na4	dl9a	vid-Ī	71 cd@Wsvaml	Cyvn						
			vid-ĒĒ	71 Aaidna4	ma@	vid-Ī	71 Aaidna4	j Nm	sid-ĒĒ	71 ivml na4	Cyvn			
			vid-ĒĒ	71 7gasna4	keI	vid-Ī	71 Aaidna4	dl9a	sid-ĒĒ	71 Aij tna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 Aij tna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			
									sid-ĒĒ	71 7gasna4	Cyvn			
									vid-Ī	71 7gasna4	Cyvn			

MARCH 2021

મહા - ફાગણ

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
		૨	1	૪	2	૫	3	૬	4	૭	5	૮	6
		મહા વદ બીજ		મહા વદ ચોથ		મહા વદ પાંચમ		શ્રી સુપાર્શ્વનાથ કેવલ મહા વદ છઠ		શ્રી સુપાર્શ્વનાથ મોક્ષ શ્રી ચંદ્રમભસ્વામી કેવલ મહા વદ સાતમ		VIRTUAL SNATRA PUJA મહા વદ આઠમ	
૮	7	૧૦	8	૧૧	9	૧૨	10	૧૩	11	૧૪	12	૩૦	13
PHILOSOPHY CLASS શ્રી સુવિધિનાથ અવન મહા વદ નોમ		મહા વદ દસમ		શ્રી આદિનાથ કેવલ મહા વદ અગ્યારસ		શ્રી શ્રેયાંસનાથ જન્મ શ્રી મુનિસુવ્રતસ્વામી કેવલ મહા વદ બારસ		શ્રી શ્રેયાંસનાથ દીક્ષા મહા વદ તેરસ		શ્રી વાસુપૂજ્યસ્વામી જન્મ મહા વદ ચૌદશ		શ્રી વાસુપૂજ્યસ્વામી દીક્ષા મહા વદ અમાસ	
૧	14	૨	15	૩	16	૪	17	૫	18	૬	19	૭	20
LANGUAGE/SUTRA CLASS DAYLIGHT SAVING TIME BEGINS ફાગણ સુદ		શ્રી અરનાથ અવન ફાગણ સુદ બીજ		ફાગણ સુદ ત્રીજ		શ્રી મલ્લિનાથ અવન ફાગણ સુદ ચોથ		ફાગણ સુદ પાંચમ		ફાગણ સુદ છઠ		FIRST DAY OF SPRING રોહિણી ચોમાસી અઠાઈ શરૂ ફાગણ સુદ પ્ર.સાતમ	
૭	21	૮	22	૯	23	૧૦	24	૧૧	25	૧૨	26	૧૪	27
PHILOSOPHY CLASS ફાગણ સુદ દ્વિ.સાતમ		શ્રી સંભવનાથ અવન ફાગણ સુદ આઠમ		ફાગણ સુદ નોમ		ફાગણ સુદ દસમ		ફાગણ સુદ અગ્યારસ		શ્રી સિધ્ધાયલજ્ઞની છ ગાઉની યાત્રા શ્રી મુનિસુવ્રતસ્વામી દીક્ષા શ્રી મલ્લિનાથ મોક્ષ ફાગણ સુદ બારસ		ચોમાસી ચૌદશ ફાગણ સુદ ચૌદશ	
૧૫	28	૧	29	૨	30	૩	31						
LANGUAGE/SUTRA CLASS ફાગણ સુદ પૂનમ		ફાગણ વદ		ફાગણ વદ બીજ		ફાગણ વદ ત્રીજ							
										MONTH	SUNRISE	NAVKASHI	SUNSET
										March 1 to 7	6:29am	7:17am	5:44pm
										March 8 to 15	7:18am	8:06am	6:52pm
										March 16 to 22	7:05am	7:53am	7:00pm
										March 23 to 31	6:54am	7:42am	7:08pm

CHOMASI ATTHAI STARTS - SATURDAY, MARCH 20

ચોમાસી અઠાઈ શરૂ - શનિવાર, માર્ચ ૨૦

CHOMASI CHAUDUSH - SATURDAY, MARCH 27

ચોમાસી ચૌદશ - શનિવાર, માર્ચ ૨૭

■ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.

■ Please refrain from eating any vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

🙏 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

જૈન તપ આરાધનાની આવશ્યક ક્રિયાઓ

તપ - સ્વરૂપ : ઇચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહિ જ આત્મા, વરતે નિજ ગુણ ભાગે રે.

ફળ : કર્મ ખપાવે ચીકણા, ભાવ મંગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ.

જૈન શાસનનાં તપ અનેકવિધ એકાંગી નથી, એમાં તો સૂર્યના કિરણો જેમ બાર બાર પ્રકાર છે. જેમાં છ બાહ્ય (અનશરણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ ત્યાગ, કાયા, કલેશ, સંલીનતા) અને છ અભ્યંતર (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ) એવી બાર પાંખડીઓથી ખીલેલું તપશ્ચર્યા કમળ ઇષ્ટફલની સિધ્ધિ પ્રાપ્ત કરાવે છે અને મોક્ષ સુખને આપે છે.

દેહ દૂર્લભ માનવભવ મળ્યો સાથે શ્રી દેવ ગુરુ ધર્મની અપૂર્વ સામગ્રી મળી તે છતાં પ્રમાદ સેવી દેહપોષણ રક્ષણ અને તેનાં વર્ધનનાં કાર્યમાં જ પ્રવર્તવા પછી પણ દેહનું રાખ સિવાય કોઈ રૂપાંતર નથી. તો તે પરિસ્થિતિ આવે તે પહેલાં દેહ આત્માના ભિન્ન સ્વરૂપ વિચારીનિજગુણ રમણતા પ્રાપ્ત કરવા શ્રી અનંતજ્ઞાની પરમાત્માએ બતાવેલ વિવિધ તપના પ્રકારો છે. અત્રે તેમના જૈન શાસનમાં જાણિતા, ઉપયોગી નાના મોટા તપને વિધિ કોઠારૂપે દરેકને સરળ બની રહે તે રીતે આપવામાં આવેલ છે. જૈનો સદ ઉપયોગ કરી કરાવી ઇષ્ટફળ સિધ્ધિના સાધક બનશો.

સમ્યગ્દૃષ્ટિ, શાંત, અલ્પ આહારી, વિશય કામના ભોગ રહિત, કષાયવર્જિત, ધૈર્યવાન, અન્યને નિંદા નહીં કરનાર, ગુરુ દેવોની સેવામાં તત્પર, દયાળુ, વિનયી, ક્ષમાવાન, પરની ઇર્ષા નહીં કરનાર તેમજ મિથ્યા પર્વને નહીં માનનાર આદિ ગુણોને ધારણ કરનારની તપશ્ચર્યા ફળને આપનારી ક્રિયા બને છે, માટે દરેક તપસ્વી આરાધકોએ ઉપરોક્ત ગુણોને જીવનમાં કેળવવા માટે યથાશક્ય પ્રયાસ અવશ્ય કરવો જોઈએ.

દરેક તપમાં કરવાની આવશ્યક વિધિ

૧. બે ટંક સવાર સાંજ પ્રતિક્રમણ કરવું.
૨. બે ટંક સવાર સાંજ વપરાતી વસ્તુનું પડિલેહણ કરવું.
૩. હંમેશા ત્રિકાળ જિનેશ્વર ભગવાનના દર્શન, અષ્ટપ્રકારી પૂજા સ્નાદિ ભક્તિ કરવી.
૪. સવાર, બપોર અને સાંજે વિધિપૂર્વક દેવવંદન કરવું.
૫. વિધિપૂર્વક પચ્ચક્ષાણ કરવું અને પારવું
૬. ગુરુ ભગવંતો પાસેથી તપના મહિમાની જાણ કરવી. ગુરુ વંદન કરવા અને તેમની પાસે પચ્ચક્ષાણ લેવા.
૭. જ્ઞાનની પૂજાભક્તિ કરવી.
૮. પ્રભુસમક્ષ બતાવેલ સંખ્યા પ્રમાણે અક્ષતના સાથિયા કરી તેના ઉપર યથાશકિત ફળ, નિવેદ્ય, ચઢાવવા
૯. દરેક તપમાં બતાવેલ પ્રમાણે ૨૦ નવકારવાળી ગણાવી.
૧૦. તપમાં દર્શાવેલ સંખ્યા પ્રમાણે ખમાસમણા દેવા.
૧૧. તપમાં દર્શાવેલ સંખ્યા પ્રમાણે લોગ્ગસનો કાઉસગ્ગ કરવો.
૧૨. જ્યાં જ્યાં ગુરુ પૂજા કહી હોય ત્યાં ત્યાં ગુરુ પાસે સ્વસ્તિક કરી તે ઉપર યથાશકિત દ્રવ્ય મૂકવું અને ગુરુ મહારાજને વંદના કરી તેમની પાસેથી વાસક્ષેપ લેવો.
૧૩. તપશ્ચર્યાના દિવસે સ્વાધ્યાય વિશષ પ્રકારે કરવો.
૧૪. બ્રહ્મચર્ય પાળવું અને ભૂશિયન (સંથારે સુવું) કરવું
૧૫. તપ આત્મલક્ષી હોય દરેક પ્રકારના આરંભ સમારંભાદિક કાચાર્ઠ છોડવા.
૧૬. ઇચ્છાનિરોધસ્તપ જણાવેલ હોય દરેક તપમાં અલ્પ આહારી રાખવો. ઘી દૂધ માવો મીઠાઈ મેવો તપના ભાવનેબાધક હોય, ત્યાગ કરવો....પાણી સાથે આઠ કે અગ્યાર વસ્તુનો જ વપરાશ થાય તે ઉત્તમ છે. સામુદાયિક આરાધનમાં જે વસ્તુ હોય તે જ વાપરવી. ઘરની કે બહારની વસ્તુ વપરાય જ નહીં.
૧૭. સામુદાયિ સામુહિક ક્રિયા આરાધના શ્રેષ્ઠ માર્ગ છે.
૧૮. તપની પૂર્તિમાં ઉદ્યાપન અનુકૂળતા મુજબ કરવું.
૧૯. દરેક તપશ્ચર્યામાં ઉકાળેલું પાણી સૂર્યાદય પછી વાપરવું. ઉકાળેલું પાણી ઉફળા આચ્યા પછી જ વપરાય. તે વિનાના પાણી વાપરનાર તથા વહોરનાર દોષીત છે.
૨૦. દરેક તપમાં આસન નીચું અને ભોજનથાળ ઊંચો (પાટલા પર) રાખવો.



Jai Jinendra from The Dedhia Family
Dev & Damyanti, Samir & Sheena , Sachin & Dipti Dedhia
Shaan, Shailin, Saiyan, Diav & Kallan Dedhia



APRIL 2021

ફાગણ - ચૈત્ર

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
				MONTH April 1 to 7 April 8 to 15 April 16 to 22 April 23 to 30	SUNRISE 6:39am 6:27am 6:15am 6:04am	NAVKASHI 7:27am 7:15am 7:03am 6:52am	SUNSET 7:17pm 7:25pm 7:33pm 7:41pm	૪	1	૫	2	૭	3
								શ્રી પાર્શ્વનાથ ચવન શ્રી પાર્શ્વનાથ કેવલ ફાગણ વદ ચોથ		શ્રી ચંદ્રપ્રભસ્વામી ચવન ફાગણ વદ પાંચમ		VIRTUAL SNATRA PUJA ફાગણ વદ સાતમ	
૮	4	૯	5	૧૦	6	૧૧	7	૧૨	8	૧૩	9	૧૩	10
વર્ષાતપ પ્રારંભ PHILOSOPHY CLASS શ્રી આદિનાથ જન્મ શ્રી આદિનાથ દીક્ષા ફાગણ વદ આઠમ		ફાગણ વદ નોમ		ફાગણ વદ દસમ		ફાગણ વદ અગ્યારસ		ફાગણ વદ બારસ		ફાગણ વદ પ્ર. તેરસ		ફાગણ વદ દ્વિ. તેરસ	
૧૪	11	૩૦ ●	12	૧	13	૨	14	૩	15	૪	16	૫	17
LANGUAGE/SUTRA CLASS ફાગણ વદ ચૌદશ		ફાગણ વદ અમાસ		ચૈત્ર સુદ		ચૈત્ર સુદ બીજ		શ્રી કુંથુનાથ કેવલ ચૈત્ર સુદ ત્રીજ		રોહિણી ચૈત્ર સુદ ચોથ		શ્રી અજિતનાથ મોક્ષ શ્રી સંભવનાથ મોક્ષ શ્રી અનંતનાથ મોક્ષ ચૈત્ર સુદ પાંચમ	
૬	18	૭	19	૮	20	૯	21	૧૦	22	૧૧	23	૧૨	24
PHILOSOPHY CLASS ચૈત્ર સુદ છઠ		આયંબિલની ઓળી શરૂ ચૈત્ર સુદ સાતમ		ચૈત્ર સુદ આઠમ		શ્રી સુમતિનાથ મોક્ષ ચૈત્ર સુદ નોમ		ચૈત્ર સુદ દસમ		શ્રી સુમતિનાથ કેવલ ચૈત્ર સુદ અગ્યારસ		NAVAPAD PUJA ચૈત્ર સુદ બારસ	
૧૩	25	૧૪	26	૧૫	27	૨	28	૩	29	૪	30		
LANGUAGE/SUTRA CLASS MAHAVIR JANMA KALYANK PUJA શ્રી મહાવીરસ્વામી જન્મ ચૈત્ર સુદ તેરસ		ચૈત્ર સુદ ચૌદશ		શ્રી સિધ્ધાચલજીની મહાયાત્રા શ્રી પદ્મપ્રભસ્વામી કેવલ ચૈત્ર સુદ પૂનમ		શ્રી કુંથુનાથ મોક્ષ શ્રી શીતલનાથ મોક્ષ ચૈત્ર વદ		ચૈત્ર વદ ત્રીજ		ચૈત્ર વદ ચોથ			

AAYAMBIL OLI - MONDAY, APRIL, 19 -- TUESDAY, APRIL, 27
 આયંબિલની ઓળી - સોમવાર, ઓક્ટોબર ૧૯ - મંગળવાર, ઓક્ટોબર ૨૭
 SHRI MAHAVIRSWAMI JANMA KALYAANAK - SUNDAY, APRIL 25
 શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણક - રવિવાર, એપ્રિલ ૨૫

■ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.
 ■ Please refrain from eating any vegetables and fruits on this day

◆ Auspicious Days
 ◆ શુભ દિવસો
 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

નવકાશી પોરિસી વગેરે પચ્ચકૂખાણો કયારે આવે ?

તેની સાદી સમજ

૧. સુર્યોદયથી સુર્યાસ્ત સુધીના સમયને દિવસ કહેવાય છે.
૨. સુર્યોદયથી સુર્યાસ્ત સુધીના સમયના ચાર સરખા ભાગ કરવામાં આવે, તો તેના એક ભાગને એક પ્રહર કહેવામાં આવે છે. દિવસમાં તેવા ચાર પ્રહર હોય છે.
૩. કાયમ માટે દરેક દિવસે સુર્યોદય પછી ૪૮ મીનીટેજ નવકારશી પચ્ચકૂખાણ આવી જ જાય છે.
૪. સુર્યોદયના સમયમાં દિવસનો એક ભાગ એક પ્રહર ઉમેરવાથી પોરિસીના પચ્ચકૂખાણનો સમય આવી જાય છે.
૫. સુર્યોદયના સમયમાં દિવસનો એક ભાગ અને બીજા ભાગનો અર્ધો ભાગ દોઢ પ્રહર ઉમેરવાથી સાઢ પોરિસીના પચ્ચકૂખાણનો સમય આવી જાય છે.
૬. સુર્યોદયના સમયમાં દિવસના બે ભાગ બે પ્રહર ઉમેરવાથી પુરિમુકું પચ્ચકૂખાણનો સમય આવી જાય છે.
૭. સુર્યોદયના સમયમાં દિવસના ત્રણ ભાગ ત્રણ પ્રહર ઉમેરવાથી અવકૂ પચ્ચકૂખાણનો સમય આવી જાય છે.
૮. સુર્યોદયના સમયમાં દિવસના ચારેય ભાગ ચાર પ્રહર ઉમેરતાં સુર્યોદયના સમય આવી જાય છે.
૯. દરેક સ્થળે સુર્યોદયથી સુર્યાસ્ત સુધીનો જેટલો સમય હોય તેના સરખા ચાર ભાગ કરીને ઉપરના નિયમ પ્રમાણે તે દિવસના સુર્યોદયમાં તે સમય ઉમેરતાં તે તે દરેક પચ્ચકૂખાણનો સમય આવી જાય છે.

મહત્વની સુચના


આ પચ્ચકૂખાણોના સમય વોન્ગ આયલેન્ડ ના સમય પ્રમાણે છે.

મર્યા અને નવેમ્બરમાં સમય બદલાતો હોવાથી સમયની ગણતરીમાં ફેરફાર કરવો.

મહીના	સુર્યોદય	નવકારશી	પોરસી	સાઢપોરસી	પુરિમકૂ	અવકૂ	સુર્યાસ્ત
જાન્યુ. ૧ થી ૭	૭:૧૮	૮:૦૬	૯:૩૯	૧૦:૪૯	૧૨:૦૦	૨:૨૦	૪:૩૬
જાન્યુ. ૮ થી ૧૫	૭:૧૮	૮:૦૬	૯:૪૨	૧૦:૫૩	૧૨:૦૫	૨:૨૯	૪:૪૨
જાન્યુ. ૧૬ થી ૨૨	૭:૧૬	૮:૦૪	૯:૪૨	૧૦:૫૫	૧૨:૦૯	૨:૩૫	૪:૫૧
જાન્યુ. ૨૩ થી ૩૧	૭:૧૨	૮:૦૦	૯:૪૨	૧૦:૫૮	૧૨:૧૪	૨:૪૪	૫:૦૦
ફેબ્રુ. ૧ થી ૭	૭:૦૫	૭:૫૩	૯:૪૦	૧૦:૫૭	૧૨:૧૪	૨:૪૯	૫:૧૦
ફેબ્રુ. ૮ થી ૧૫	૬:૫૭	૭:૪૫	૯:૩૭	૧૦:૫૭	૧૨:૧૬	૨:૫૫	૫:૧૯
ફેબ્રુ. ૧૬ થી ૨૨	૬:૪૮	૭:૩૩	૯:૩૨	૧૦:૫૪	૧૨:૧૭	૩:૦૧	૫:૨૮
ફેબ્રુ. ૨૩ થી ૨૯	૬:૩૮	૭:૨૬	૯:૨૬	૧૦:૫૦	૧૨:૧૪	૩:૦૨	૫:૩૬
માર્ચ ૧ થી ૭	૬:૨૯	૭:૧૭	૯:૨૨	૧૦:૪૮	૧૨:૧૪	૩:૦૭	૫:૪૪
માર્ચ ૮ થી ૧૫	૭:૧૮	૮:૦૬	૧૦:૧૬	૧૧:૪૫	૧:૧૪	૪:૧૨	૬:૫૨
માર્ચ ૧૬ થી ૨૨	૭:૦૫	૭:૫૩	૧૦:૦૯	૧૧:૪૦	૧:૧૨	૪:૧૬	૭:૦૦
માર્ચ ૨૩ થી ૩૧	૬:૫૪	૭:૪૨	૧૦:૦૩	૧૧:૩૩	૧:૧૨	૪:૨૧	૭:૦૮
એપ્રિલ ૧ થી ૭	૬:૩૯	૭:૨૭	૯:૫૩	૧૧:૩૦	૧:૦૭	૪:૨૦	૭:૧૭
એપ્રિલ ૮ થી ૧૫	૬:૨૭	૭:૧૫	૯:૪૯	૧૧:૨૬	૧:૦૫	૪:૨૪	૭:૨૫
એપ્રિલ ૧૬ થી ૨૨	૬:૧૫	૭:૦૩	૯:૩૮	૧૧:૨૦	૧:૦૨	૪:૨૫	૭:૩૩
એપ્રિલ ૨૩ થી ૩૦	૬:૦૪	૬:૫૨	૯:૩૨	૧૧:૧૬	૧:૦૧	૪:૨૯	૭:૪૧
મે ૧ થી ૭	૫:૫૩	૬:૪૧	૯:૨૫	૧૧:૧૧	૧૨:૫૬	૪:૩૦	૭:૪૯
મે ૮ થી ૧૫	૫:૪૫	૬:૩૩	૯:૨૨	૧૧:૧૦	૧૨:૫૮	૪:૩૫	૭:૫૬
મે ૧૬ થી ૨૨	૫:૩૬	૬:૨૪	૯:૧૬	૧૧:૦૬	૧૨:૫૬	૪:૩૫	૮:૦૪
મે ૨૩ થી ૩૧	૫:૩૦	૬:૧૮	૯:૧૩	૧૧:૦૪	૧૨:૫૬	૪:૩૮	૮:૧૧
જૂન ૧ થી ૭	૫:૨૫	૬:૧૩	૯:૧૦	૧૧:૦૨	૧૨:૫૫	૪:૩૯	૮:૧૮
જૂન ૮ થી ૧૫	૫:૨૩	૬:૧૧	૯:૧૦	૧૧:૦૨	૧૨:૫૬	૪:૪૨	૮:૨૩
જૂન ૧૬ થી ૨૨	૫:૨૩	૬:૧૧	૯:૧૦	૧૧:૦૩	૧૨:૫૭	૪:૪૩	૮:૨૭
જૂન ૨૩ થી ૩૦	૫:૨૫	૬:૧૩	૯:૧૨	૧૧:૦૫	૧૨:૫૮	૪:૪૫	૮:૨૯
જુલાઈ ૧ થી ૭	૫:૨૯	૬:૧૭	૯:૧૫	૧૧:૦૮	૧:૦૧	૪:૪૬	૮:૨૮
જુલાઈ ૮ થી ૧૫	૫:૩૫	૬:૨૩	૯:૨૦	૧૧:૧૨	૧:૦૪	૪:૪૯	૮:૨૫
જુલાઈ ૧૬ થી ૨૨	૫:૪૧	૬:૨૯	૯:૨૩	૧૧:૧૪	૧:૦૫	૪:૪૭	૮:૨૪
જુલાઈ ૨૩ થી ૩૧	૫:૫૯	૬:૩૭	૯:૨૯	૧૧:૧૮	૧:૦૮	૪:૪૮	૮:૨૨
ઓગસ્ટ ૧ થી ૭	૫:૫૬	૬:૪૪	૯:૩૧	૧૧:૧૯	૧:૦૭	૪:૪૨	૮:૦૪
ઓગસ્ટ ૮ થી ૧૫	૬:૦૩	૬:૫૧	૯:૩૫	૧૧:૨૦	૧:૦૬	૪:૩૮	૭:૫૪
ઓગસ્ટ ૧૬ થી ૨૨	૬:૧૦	૬:૫૮	૯:૩૭	૧૧:૨૧	૧:૦૫	૪:૩૧	૭:૪૪
ઓગસ્ટ ૨૩ થી ૩૧	૬:૧૯	૭:૦૭	૯:૪૨	૧૧:૨૩	૧:૦૫	૪:૨૭	૭:૩૦
સપ્ટેમ્બર ૧ થી ૭	૬:૨૬	૭:૧૪	૯:૪૨	૧૧:૨૩	૧:૦૦	૪:૧૭	૭:૧૭
સપ્ટેમ્બર ૮ થી ૧૫	૬:૩૪	૭:૨૨	૯:૪૭	૧૧:૨૩	૧૨:૫૯	૪:૧૨	૭:૦૫
સપ્ટેમ્બર ૧૬ થી ૨૨	૬:૪૧	૭:૨૯	૯:૪૮	૧૧:૨૨	૧૨:૫૫	૪:૦૨	૬:૫૩
સપ્ટેમ્બર ૨૩ થી ૩૦	૬:૪૯	૭:૩૭	૯:૫૧	૧૧:૨૨	૧૨:૫૪	૩:૫૬	૬:૪૦
ઓક્ટોબર ૧ થી ૭	૬:૫૬	૭:૪૪	૯:૫૩	૧૧:૨૨	૧૨:૫૦	૩:૪૭	૬:૨૮
ઓક્ટોબર ૮ થી ૧૫	૭:૦૫	૭:૫૩	૯:૫૭	૧૧:૨૩	૧૨:૫૦	૩:૪૨	૬:૧૫
ઓક્ટોબર ૧૬ થી ૨૨	૭:૧૨	૮:૦૦	૯:૫૯	૧૧:૨૩	૧૨:૪૮	૩:૩૨	૬:૦૫
ઓક્ટોબર ૨૩ થી ૩૦	૭:૨૩	૮:૧૧	૧૦:૦૬	૧૧:૨૭	૧૨:૪૮	૩:૩૧	૫:૫૨
નવેમ્બર ૧ થી ૭	૬:૩૧	૭:૧૯	૯:૦૭	૧૦:૨૭	૧૧:૪૪	૨:૨૦	૪:૪૪
નવેમ્બર ૮ થી ૧૫	૬:૪૦	૭:૨૮	૯:૧૨	૧૦:૨૮	૧૧:૪૫	૨:૧૭	૪:૩૭
નવેમ્બર ૧૬ થી ૨૨	૬:૪૮	૭:૩૬	૯:૧૮	૧૦:૩૩	૧૧:૪૮	૨:૧૭	૪:૩૧
નવેમ્બર ૨૩ થી ૩૦	૬:૫૭	૭:૪૫	૯:૨૨	૧૦:૩૫	૧૧:૪૮	૨:૧૩	૪:૨૮
ડિસેમ્બર ૧ થી ૭	૭:૦૪	૭:૫૨	૯:૨૬	૧૦:૩૭	૧૧:૪૯	૨:૧૧	૪:૨૬
ડિસેમ્બર ૮ થી ૧૫	૭:૧૧	૭:૫૯	૯:૩૨	૧૦:૪૨	૧૧:૫૨	૨:૧૩	૪:૨૬
ડિસેમ્બર ૧૬ થી ૨૨	૭:૧૫	૮:૦૩	૯:૩૫	૧૦:૪૫	૧૧:૫૫	૨:૧૫	૪:૨૬
ડિસેમ્બર ૨૩ થી ૩૧	૭:૧૮	૮:૦૬	૯:૩૮	૧૦:૪૮	૧૧:૫૮	૨:૧૮	૪:૩૦



Jai Jinendra to all, Happy New Year.
Sahil, Priyanka, Snehal and Preyas S Shah



MAY 2021

ચૈત્ર - વૈશાખ

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
૫	30	૬	31									૫	1
PHILOSOPHY CLASS (MEMORIAL WEEKEND)		MEMORIAL DAY શ્રી શ્રેયાંસનાથ અવન વૈશાખ વદ પાંચમ										VIRTUAL SNATRA PUJA શ્રી કુંથુનાથ દીક્ષા ચૈત્ર વદ પાંચમ	
૬	2	૭	3	૮	4	૯	5	૧૦	6	૧૧	7	૧૨	8
PHILOSOPHY CLASS શ્રી શીતલનાથ અવન ચૈત્ર વદ છઠ		ચૈત્ર વદ સાતમ	ચૈત્ર વદ આઠમ	ચૈત્ર વદ નોમ				શ્રી નમિનાથ મોક્ષ ચૈત્ર વદ દસમ		ચૈત્ર વદ અગ્યારસ		ચૈત્ર વદ બારસ	
૧૩	9	૧૪	10	૩૦	11	૧	12	૨	13	૩	14	૩	15
LANGUAGE/SUTRA CLASS MOTHER'S DAY શ્રી અનંતનાથ જન્મ ચૈત્ર વદ તેરસ		શ્રી અનંતનાથ દીક્ષા શ્રી અનંતનાથ કેવલ શ્રી કુંથુનાથ જન્મ ચૈત્ર વદ ચૌદશ		ચૈત્ર વદ અમાસ	વૈશાખ સુદ			રોહિણી વૈશાખ સુદ બીજ		વૈશાખ સુદ પ્ર.ત્રીજ		અક્ષયતૃતિયા વર્ષાતપ પારણા વૈશાખ સુદ દ્વિ.ત્રીજ	
૪	16	૫	17	૬	18	૭	19	૮	20	૯	21	૧૦	22
PHILOSOPHY CLASS શ્રી અભિનંદનસ્વામી અવન વૈશાખ સુદ ચોથ		વૈશાખ સુદ પાંચમ	વૈશાખ સુદ છઠ	શ્રી ધર્મનાથ અવન વૈશાખ સુદ સાતમ				શ્રી અભિનંદનસ્વામી મોક્ષ શ્રી સુમતિનાથ જન્મ વૈશાખ સુદ આઠમ		શ્રી સુમતિનાથ દીક્ષા વૈશાખ સુદ નોમ		શ્રી મહાવીરસ્વામી કેવલ વૈશાખ સુદ દસમ	
૧૧	23	૧૩	24	૧૪	25	૧૫	26	૧	27	૨	28	૩	29
CHJS ANNIVERSARY WEEKEND ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના વૈશાખ સુદ અગ્યારસ		શ્રી વિમલનાથ અવન શ્રી અજિતનાથ અવન વૈશાખ સુદ તેરસ	વૈશાખ સુદ ચૌદશ	વૈશાખ સુદ પૂનમ				વૈશાખ વદ		વૈશાખ વદ બીજ		વૈશાખ વદ ત્રીજ	

AKSHAY TRUTIYA - VARSHITAP PARNA - SATURDAY, MAY 15

અક્ષયતૃતિયા - વર્ષાતપ પારણા - શનિવાર, મૈ ૧૫

■ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.

■ Please refrain from eating any vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

🙏 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

Pacchkhaan Timings (As per New York Local Time)

Simple Explanation of Appropriate Time to do Different Pacchkhaans

At any given place on any given day, one can determine the appropriate time to do the Pacchkhaans by following the guidelines stated below:

- (1) The time period from sunrise to sunset is considered as the Day.
- (2) The time period from sunrise to sunset is divided into four equal parts known as Prahar (Quadrants). So there are total of 4 Prahars or Quadrants in one day.
- (3) Appropriate time to do Navkaarshi on any day is 48 minutes after the sunrise time.
- (4) Appropriate time to do Porisi is after adding time of one quadrant to the sunrise time.
- (5) Appropriate time to do Saadhporisi is after adding time of one and half quadrant to the sunrise time.
- (6) Appropriate time to do Purimaddha is after adding time of two quadrants to the sunrise time.
- (7) Appropriate time to do Avaddha is after adding time of three quadrants to the sunrise time.
- (8) Everyday by adding four quadrants to the sunrise time, one arrives at the sunset time.

IMPORTANT NOTES

The timings in this tabulation is based on local time in New York.

Note the Daylight Savings Time Change in March and November.

MONTH	SUNRISE	NAVKASHI	PORSI	SAADHPORSI	PURIMADDHA	AVADDHA	SUNSET
January 1 to 7	7:18am	8:06am	9:39am	10:49am	12:00pm	2:20pm	4:36pm
January 8 to 15	7:18am	8:06am	9:42am	10:53am	12:05pm	2:29pm	4:42pm
January 16 to 22	7:16am	8:04am	9:42am	10:55am	12:09pm	2:35pm	4:41pm
January 23 to 31	7:12am	8:00am	9:42am	10:58am	12:14pm	2:44pm	5:00pm
February 1 to 7	7:05am	7:53am	9:40am	10:57am	12:14pm	2:49pm	5:10pm
February 8 to 15	6:57am	7:45am	9:37am	10:57am	12:16pm	2:55pm	5:19pm
February 16 to 22	6:48am	7:33am	9:32am	10:54am	12:17pm	3:01pm	5:28pm
February 23 to 29	6:38am	7:26am	9:26am	10:50am	12:14pm	3:02pm	5:36pm
March 1 to 7	6:29am	7:17am	9:22am	10:48am	12:14pm	3:07pm	5:44pm
March 8 to 15	7:18am	8:06am	10:16am	11:45am	1:14pm	4:12pm	6:52pm
March 16 to 22	7:05am	7:53am	10:09am	11:40am	1:12pm	4:16pm	7:00pm
March 23 to 31	6:54am	7:42am	10:03am	11:33am	1:12pm	4:21pm	7:08pm
April 1 to 7	6:39am	7:27am	9:53am	11:30am	1:07pm	4:20pm	7:17pm
April 8 to 15	6:27am	7:15am	9:46am	11:26am	1:05pm	4:24pm	7:25pm
April 16 to 22	6:15am	7:03am	9:38am	11:20am	1:02pm	4:25pm	7:33pm
April 23 to 30	6:04am	6:52am	9:32am	11:16am	1:01pm	4:29pm	7:41pm
May 1 to 7	5:53am	6:41am	9:25am	11:11am	12:58pm	4:30pm	7:49pm
May 8 to 15	5:45am	6:33am	9:22am	11:10am	12:58pm	4:35pm	7:56pm
May 16 to 22	5:36am	6:24am	9:16am	11:06am	12:56pm	4:35pm	8:04pm
May 23 to 31	5:30am	6:18am	9:13am	11:04am	12:56pm	4:38pm	8:11pm
June 1 to 7	5:25am	6:13am	9:10am	11:02am	12:55pm	4:39pm	8:18pm
June 8 to 15	5:23am	6:11am	9:10am	11:02am	12:56pm	4:42pm	8:23pm
June 16 to 22	5:23am	6:11am	9:10am	11:03am	12:57pm	4:43pm	8:27pm
June 23 to 30	5:35am	6:13am	9:12am	11:05am	12:58pm	4:45pm	8:29pm
July 1 to 7	5:39am	6:17am	9:15am	11:08am	1:01pm	4:46pm	8:28pm
July 8 to 15	5:35am	6:23am	9:20am	11:12am	1:04pm	4:49pm	8:25pm
July 16 to 22	5:41am	6:29am	9:23am	11:14am	1:05pm	4:47pm	8:24pm
July 23 to 31	5:49am	6:37am	9:29am	11:18am	1:08pm	4:48pm	8:12pm
August 1 to 7	5:56am	6:44am	9:31am	11:19am	1:07pm	4:42pm	8:04pm
August 8 to 15	6:03am	6:51am	9:35am	11:20am	1:06pm	4:38pm	7:54pm
August 16 to 22	6:10am	6:58am	9:37am	11:21am	1:05pm	4:31pm	7:44pm
August 23 to 31	6:19am	7:07am	9:42am	11:23am	1:05pm	4:27pm	7:30pm
September 1 to 7	6:26am	7:14am	9:43am	11:23am	1:00pm	4:17pm	7:17pm
September 8 to 15	6:34am	7:22am	9:47am	11:23am	12:59pm	4:12pm	7:05pm
September 16 to 22	6:41am	7:29am	9:48am	11:22am	12:55pm	4:02pm	6:53pm
September 23 to 30	6:49am	7:37am	9:51am	11:22am	12:54pm	3:56pm	6:40pm
October 1 to 7	6:56am	7:44am	9:53am	11:22am	12:50pm	3:47pm	6:28pm
October 8 to 15	7:05am	7:53am	9:57am	11:23am	12:50pm	3:42pm	6:15pm
October 16 to 22	7:12am	8:00am	9:59am	11:23am	12:48pm	3:32pm	6:05pm
October 23 to 30	7:23am	8:11am	10:06am	11:27am	12:48pm	3:31pm	5:52pm
November 1 to 7	6:31am	7:19am	9:07am	10:27am	11:44am	2:20pm	4:44pm
November 8 to 15	6:40am	7:28am	9:12am	10:28am	11:45am	2:17pm	4:37pm
November 16 to 22	6:48am	7:36am	9:18am	10:33am	11:48am	2:17pm	4:31pm
November 23 to 30	6:57am	7:45am	9:22am	10:35am	11:48am	2:13pm	4:28pm
December 1 to 7	7:04am	7:52am	9:26am	10:37am	11:49am	2:11pm	4:26pm
December 8 to 15	7:11am	7:59am	9:32am	10:42am	11:52am	2:13pm	4:26pm
December 16 to 22	7:15am	8:03am	9:35am	10:45am	11:55am	2:15pm	4:27pm
December 23 to 31	7:18am	8:06am	9:38am	10:48am	11:58am	2:18pm	4:30pm



॥ मंगलम भगवान वीरो, मंगलम स्थुलीभद्राध्याय, मंगलम गौतम प्रभु, जैन धर्मास्तु मंगलम ॥

Ramesh & Pushpa, Bhavin & Hetal, Sanjana, Sajan Shah

Paresh & Nippa, Reema, Kushal Doshi



JUNE 2021

વૈશાખ - જેઠ

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
				૭	1	૮	2	૯	3	૧૦	4	૧૦	5
				વૈશાખ વદ સાતમ		શ્રી મુનિસુવ્રતસ્વામી જન્મ વૈશાખ વદ આઠમ		શ્રી મુનિસુવ્રતસ્વામી મોક્ષ વૈશાખ વદ નોમ		વૈશાખ વદ પ્ર.દસમ		VIRTUAL SNATRA PUJA વૈશાખ વદ દ્વિ.દસમ	
૧૧	6	૧૨	7	૧૩	8	૧૪	9	૩૦	10	૧	11	૨	12
PATHSHALA GRADUATION DAY વૈશાખ વદ અગ્યારસ		વૈશાખ વદ બારસ		શ્રી શાંતિનાથ જન્મ શ્રી શાંતિનાથ મોક્ષ વૈશાખ વદ તેરસ		શ્રી શાંતિનાથ દીક્ષા વૈશાખ વદ ચૌદશ		રોહિણી વૈશાખ વદ અમાસ		જેઠ સુદ		જેઠ સુદ બીજ	
૩	13	૪	14	૫	15	૬	16	૭	17	૮	18	૯	19
જેઠ સુદ ત્રીજ		જેઠ સુદ ચોથ		શ્રી ધર્મનાથ મોક્ષ જેઠ સુદ પાંચમ		જેઠ સુદ છઠ		જેઠ સુદ સાતમ		જેઠ સુદ આઠમ		શ્રી વાસુપૂજ્યસ્વામી અવન જેઠ સુદ નોમ	
૧૦	20	૧૧	21	૧૨	22	૧૪	23	૧૫	24	૧	25	૨	26
FATHER'S DAY FIRST DAY OF SUMMER જેઠ સુદ દસમ		જેઠ સુદ અગ્યારસ		શ્રી સુપાર્શ્વનાથ જન્મ જેઠ સુદ બારસ		શ્રી સુપાર્શ્વનાથ દીક્ષા જેઠ સુદ ચૌદશ		જેઠ સુદ પૂનમ		જેઠ વદ		જેઠ વદ બીજ	
૩	27	૪	28	૫	29	૬	30						
જેઠ વદ ત્રીજ		શ્રી આદિનાથ અવન જેઠ વદ ચોથ		જેઠ વદ પાંચમ		જેઠ વદ છઠ							

■ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.

■ Please refrain from eating any vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

🙏 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

svarna pCckqa` ae

nvkarXnra

]GgAestE nmparsihA miYsihA pCckqaim lPcckqa{Y c] iVvhip Aahar>As` >pa` >qa[m> sa[m> AllnT4` awagè >shsagarè >mh | ragarè >slVsmaih vi | yagarè >vaesraim lvaesr[Y.

paeris-sa! paerisna

]GgAestE nmparsihA >paeris>sa! paeris>miYsihA pCckqaim lPcckqa{Y,]GgAestE c] iVvhip Aahar>As` >pa` >qa[m> sa[m> AllnT4` awagè >shsagarè >pCOLN-kal è > idsa-mabè > sahuvy` è >mh | ragarè >slVsmaih vi | yagarè >vaesraim lvaesr[Y.

piruM^-Av`nra

st]]GgAepiruM^-Av`-miY-sihA pCckqaim lPcckqa{Y, c] iVvhip Aahar>As` >pa` >qa[m> sa[m> AllnT4` awagè >shsagarè >pCOLN-kal è > idsa-mabè > sahuvy` è >mh | ragarè >slV-smaih-vi | yagarè >vaesraim lvaesr[Y.

Akas` aibyas` nra

]GgAestE nmparasihA >paeris>sa! paeris>miYsihA >pCckqaim lPcckqa{Y.]GgAestE c] iVvhip Aahar>As` >pa` >qa[m> sa[m> AllnT4` awagè >shsagarè >pCOLNkal è > idsamabè > sahuvy` è >mh | ragarè >slVsmaih vi | yagarè >ivg{Aae UeY-pCckqaim lPcckqa{Y. AllnT4` awagè >shsagarè >I wal è > ighT4ss3%è >]ikqtivvgè > pDCcmikqAè > pairYavi` yagarè >mh | ragarè >slVsmaih vi | yagarè, Akas` > aibyas` pCckqaim lPcckqa{Y, itivhip, Aahar>As` >qa[m> sa[m> AllnT4` awagè >shsagarè > sagairyagarè > Aa]3` psarè > gcaBwta` è > pairYavi` yagarè >mh | ragarè >slV-smaih vi | yagarè, pa` Ss I è va, Al è va, ACOè va, bhuè va, sisT4è va, AisT4è va, vaesraim lvaesr[Y.

AayibI inivna

]GgAestE nmparsihA >paeris>sa! paeris>miYsihA >pCckqaim lPcckqa{Y,]GgAestE c] iVvhip Aahar>As` >pa` >qa[m> sa[m> AllnT4` awagè >shsagarè >pCOLNkal è > idsamabè > sahuvy` è >mh | ragarè >slVsmaih vi | yagarè >AayibI pCckqaim lPcckqa{Y. AllnT4` awagè >shsagarè >I wal è > ighT4ss3%è >]ikqtivvgè > pairYavi` yagarè >mh | ragarè >slVsmaih vi | yagarè Agas` pCckqaim lPcckqa{Y. itivhip, Aahar>As` >qa[m> sa[m> AllnT4` a wagè >shsagarè > sagairyagarè > Aa]3` -psarè > gcaBwta` è > pairYavi` yagarè >mh | ragarè >slV-smaih vi | yagarè >pa` Ss I è va, Al è va, ACOè va, bhuè va, sisT4è va, AisT4è va, vaesraim lvaesr[Y.

itivhar]pvasna

stae]GgAedIEY ABwtY pCckqaim lPcckqa{Y itivhip Aahar>As` >qa[m> sa[m> AllnT4` awagè >shsagarè > pairYavi` yagarè, mh | ragarè >slVsmaih vi | yagarè >pa` har paeris>sa! paeris>miYsihA pCckqaim lPcckqa{Y AllnT4` awagè >shsagarè, pCOLNkal è > idsamabè > sahuvy` è >mh | ragarè >slVsmaih vi | yagarè >pa` Ss I è va, Al è va, ACOè va, bhuè va, sisT4è va, AisT4è va, vaesraim lvaesr[Y.

c]ivhar]pvasna

stae]GgAeABwtY pCckqaim lPcckqa{Y c] iVvhip, Aahar>As` >pa` >qa[m> sa[m> AllnT4` awagè >shsagarè > pairYavi` ya garè >mh | ragarè >slVsmaih vi | yagarè >vaesraim lvaesr[Y.

svarna pa` harna

pa` har paeris>saD! paeris, miYsihA pCckqaim lPcckqa{Y, AllnT4` awagè >shsagarè > pCOLNkal è > idsamabè > sahuvy` è, >mh | ragarè >slVsmaih vi | yagarè >pa` Ss I è va, Al è va, ACOè va, bhuè va, sisT4è va, AisT4è va, vaesraim lvaesr[Y.

dsavgaisna

dsavgaisA >]vwag > pirwag > pCckqaim lPcckqa{Y, AllnT4` awagè >shsagarè > mh | ragarè >slVsmaih vi | yagarè >vaesr[lvaesraimY.

Aiwghna

Aiwgh > pCckqaim lPcckqa{Y, AllnT4` awagè >shsagarè >mh | ragarè >slVsmaih vi | yagarè >vaesraim lvaesr[Y.



stna: drle pCckqa` ma>svy>paeanI mEkrTI vqtekrnare`pCckqaim Anevaesraim` baevu t4a bl=nekravTI vqte`pCckqa{ Anevaesr[" baevu j aebyas` anupCckqa` krvehay taebyas` eAneAkas` anupCckqa` krvehay taekas` anupa# w`vae UeY- nIvInupCckqa` I euhay taevig{Aae pOI inIvlg{A>Aa pa# v2arebaevae UeY be]pvas ma3e0YwL>t`]pvas ma3eA#mwL>car]pvas ma3edsmwL>paè]pvas ma3e barswL>Aa rItepa# baevaed UAk4I v2U]pvasva5aAebl= idvs4I pa` harnupCckqa` I eua pa` har paeris 4I vaesr[sDlnaepa# baevaed Aa pCckqa` phèidvse0Y AidnupCckqa` I I6ehay Aneblj eidvsepa` I vaprvuhay Tyare svar I eanwE

Usaj-na>pCckqa` aeAak3abr mihnanI pa05 0eI



The most important principle of The Environment is that
“YOU ARE NOT THE ONLY ELEMENT”
 Aadesh, Keval, Bhavna and Deepak Nagda



JULY 2021

જેઠ - અષાઢ

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
				MONTH July 1 to 7 July 8 to 15 July 16 to 22 July 23 to 31	SUNRISE 5:39am 5:35am 5:41am 5:49am	NAVKASHI 6:17am 6:23am 6:29am 6:37am	SUNSET 8:28pm 8:25pm 8:24pm 8:12pm	૭	૧	૮	૨	૯	૩
				શ્રી વિમલનાથ મોક્ષ જેઠ વદ સાતમ				શ્રી વિમલનાથ મોક્ષ જેઠ વદ સાતમ		જેઠ વદ આઠમ		શ્રી નમિનાથ દીક્ષા જેઠ વદ નોમ	
૧૦	4	૧૧	5	૧૨	6	૧૩	7	૧૩	8	૧૪	9	૩૦ ●	10
INDEPENDENCE DAY જેઠ વદ દસમ	INDEPENDENCE DAY OBSERVED જેઠ વદ અગ્યારસ			જેઠ વદ બારસ		રોહિણી જેઠ વદ પ્ર.તેરસ		જેઠ વદ દ્વિ. તેરસ		જેઠ વદ ચૌદશ		જેઠ વદ અમાસ	
૧	11	૨	12	૩	13	૪	14	૫	15	૭	16	૮	17
અષાઢ સુદ		અષાઢ સુદ બીજ		અષાઢ સુદ ત્રીજ		અષાઢ સુદ ચોથ		અષાઢ સુદ પાંચમ		ચોમાસી અઠ્ઠાઈ શરૂ શ્રી મહાવીરસ્વામી અવન અષાઢ સુદ સાતમ		શ્રી નેમિનાથ મોક્ષ અષાઢ સુદ આઠમ	
૯	18	૧૦	19	૧૧	20	૧૨	21	૧૩	22	૧૪	23	૧૫ ○	24
અષાઢ સુદ નોમ		અષાઢ સુદ દસમ		અષાઢ સુદ અગ્યારસ		અષાઢ સુદ બારસ		અષાઢ સુદ તેરસ		ચોમાસી ચૌદશ શ્રી વાસુપૂજ્યસ્વામી મોક્ષ અષાઢ સુદ ચૌદશ		અષાઢ સુદ પૂનમ	
૨	25	૩	26	૪	27	૫	28	૬	29	૭	30	૭	31
અષાઢ વદ બીજ		શ્રી શ્રેયાંસનાથ મોક્ષ અષાઢ વદ ત્રીજ		અષાઢ વદ ચોથ		અષાઢ વદ પાંચમ		અષાઢ વદ છઠ		અષાઢ વદ પ્ર.સાતમ		શ્રી અનંતનાથ અવન અષાઢ વદ દ્વિ. સાતમ	
CHOMASI ATTHAI STARTS - FRIDAY, JULY 16 ચોમાસી અઠ્ઠાઈ શરૂ - શુક્રવાર, જુલાઈ ૧૬								<input type="checkbox"/> સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.				<input checked="" type="checkbox"/> Auspicious Days	
CHOMASI CHAUDUSH - FRIDAY, JULY 23 ચોમાસી ચૌદશ - શુક્રવાર, જુલાઈ ૨૩								<input type="checkbox"/> Please refrain from eating any vegetables and fruits on this day				<input checked="" type="checkbox"/> શુભ દિવસો	
								<input checked="" type="checkbox"/> તીર્થંકર ભગવંતોના કલ્યાણકો					

MORNING PACCHKHAANS

Navkarshi:

Ooggae soore namukkara-sahium, mutthi-sahium pacchkhaami(pacchkhai), chauvihumpi aahaarum, asanum, paanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, mahattaraa-gaarenum, savva-samahi-vattiyaa-gaarenum, vosiraami (vosirai).

Porsi – Saadhaporisi:

Ooggae soore namukkara-sahium, porisim, saadhaporisim, mutthi-sahium pacchkhaami (pacchkhai), ooggae soore, chauvihumpi aahaarum, asanum, paanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, pacchanna-kaalenum, disaa-mohenum, sahu-vayanenum, mahattaraa-gaarenum, savva-samahi-vattiyaa-gaarenum, vosiraami (vosirai).

Purimaddha – Avaddha:

Soore ooggae, purimaddha, avaddha- mutthi-sahium pacchkhaami (pacchkhai), chauvihumpi aahaarum, asanum, paanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, pacchanna-kaalenum, disaa-mohenum, sahu-vayanenum, mahattaraa-gaarenum, savva-samahi-vattiyaa-gaarenum, vosiraami (vosirai).

Ekasanu – Biyanu:

Ooggae soore namukkara-sahium, porisim, saadhaporisim, mutthi-sahium pacchkhaami (pacchkhai), ooggae soore, chauvihumpi aahaarum, asanum, paanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, pacchanna-kaalenum, disaa-mohenum, sahu-vayanenum, mahattaraa-gaarenum, savva-samahi-vattiyaa-gaarenum, vigaeo pacchkhaami (pacchkhai), anathanaa-bhogenum, sahasaa-gaarenum, levaalevenum, gihatha-sansatthenum, ukhitta-vivegenum, paduccha makhienum, paritthaavaniyaa, gaarenum, mahattaraagaarenum, savva-samaahi- vatiyaagaarenum, ekasanum biyanum pacchkhaami (pacchkhai), tivihumpi, aahaarum, asanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, saagariyaagaarenum, aaoontan-pasarenum, guruabhutthanenum, paritthaavaniyaagaarenum, mahattaraa-gaarenum, savva-samahi-vattiyaaagaarenum, paanussa, leven vaa, aleven vaa, acchen vaa, bahulen vaa, sasithen vaa, asithen vaa, vosiraami (vosirai).

Aayambil:

Ooggae soore namukkara-sahium, porisim, saadhaporisim, mutthisahium pacchkhaami (pacchkhai), ooggae soore, chauvihumpi aahaarum, asanum, paanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, pacchanna-kaalenum, disaa-mohenum, sahu-vayanenum, mahattaraa-gaarenum, savva-samahi-vattiyaa-gaarenum, aayambil pacchkhaami (pacchkhai), anathanaa-bhogenum, sahasaa-gaarenum, levaalevenum, gihatha-sansatthenum, ukhitta-vivegenum, paritthaavaniya gaarenum, mahattaraagaarenum, savva- samaahi- vatiyaagaarenum, egaasanum

pacchkhaami (pacchkhai), tivihumpi, aahaarum, asanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, saagariyaagaarenum aaoontan-pasarenum, guruabhutthanenum, paritthaavaniyaagaarenum, mahattaraagaarenum, savva-samahi-vattiyaaagaarenum, paanussa, leven vaa, aleven vaa, acchen vaa, bahulen vaa, sasithen vaa, asithen vaa, vosiraami (vosirai).

Tivihaar Upvaas:

Soore ooggae abhbatatthum pacchkhaami (pacchkhai), tivihumpi aahaarum, asanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, paritthaavaniyaagaarenum, mahattaraagaarenum, savva-samahi-vattiyaaagaarenum, paanhaar, porisim, saadhaporisim, mutthisahium, pacchkhaami (pacchkhai), annathanaa-bhogenum, sahasaa-gaarenum, pacchanakaalenum, disaa-mohenum, saahuvayanenum, mahattaraagaarenum, savva-samahi-vattiyaaagaarenum, paanussa, leven vaa, aleven vaa, acchen vaa, bahulen vaa, sasithen vaa, asithen vaa, vosiraami (vosirai).

Chauvihaar Upvaas:

Soore ooggae abhbatatthum pacchkhaami (pacchkhai), chauvihumpi, aahaarum, asanum, paanum, khaaimum, saimum, annathanaa-bhogenum, sahasaa-gaarenum, paritthaavaniyaagaarenum, mahattaraa-gaarenum, savva-samahi-vattiyaaagaarenum, vosiraami (vosirai).

Morning Paanhaar **

Paanhaar porisim, saadhaporisim, mutthi-sahium pacchkhai (pacchkhaami), annathanaa-bhogenum, sahasaa-gaarenum, pacchanna-kaalenum, disaa-mohenum, sahu-vayanenum, mahattaraa-gaarenum, savva-samahi-vattiyaa-gaarenum, paanussa, leven vaa, aleven vaa, acchen vaa, bahulen vaa, sasithen vaa, asithen vaa, vosiraami (vosirai).

Desaavgaasi

Desaavagaasium, oovabhogum, paribhogum, pacchkhaami (pacchkhai), annathanaa-bhogenum, sahasaa-gaarenum, mahattaraagaarenum, savva-samahi-vattiyaaagaarenum, vosiraami (vosirai).

Abhigraha:

Abhiggaahum pacchkhaami (pacchkhai), annathanaa-bhogenum, sahasaa-gaarenum, mahattaraagaarenum, savva-samahi-vattiyaaagaarenum, vosiraami (vosirai).

** Refer to notes of the back side of August Month

(EVENING PACCHAKHANS ARE ON THE BACKSIDE OF JUNE MONTH)



“There’s no knowledge without right faith, No conduct is possible without knowledge, without conduct, there’s no liberation, And without liberation, no deliverance.” - Mahavira (UTTARADHYAYANA SUTRA, CH 27, VERSE 30)

Best Wishes: Prasham, Vaishakhi & Chintan Shah • Pratibhaben & Surendrakumar Shah

Hriday, Diya, Bhavita & Hardik Shah * Jyotsnaben & Kamleshbhai Shah



AUGUST 2021

અષાઢ - શ્રાવણ

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
૮	1	૯	2	૧૦	3	૧૧	4	૧૨	5	૧૩	6	૧૪	7
શ્રી નમિનાથ જન્મ અષાઢ વદ આઠમ		શ્રી કુંથુનાથ અવન અષાઢ વદ નોમ		રોહિણી અષાઢ વદ દસમ		અષાઢ વદ અગ્યારસ		અષાઢ વદ બારસ		અષાઢ વદ તેરસ		VIRTUAL SNATRA PUJA અષાઢ વદ ચૌદશ	
૩૦	8	૧	9	૨	10	૩	11	૪	12	૫	13	૬	14
અષાઢ વદ અમાસ		શ્રાવણ સુદ		શ્રી સુમતિનાથ અવન શ્રાવણ સુદ બીજ		શ્રાવણ સુદ ત્રીજ		૧ મહિનાના ઉપવાસ શરૂ શ્રાવણ સુદ ચોથ		શ્રી નેમિનાથ જન્મ શ્રાવણ સુદ પાંચમ		શ્રી નેમિનાથ દીક્ષા શ્રાવણ સુદ છઠ	
૭	15	૮	16	૧૦	17	૧૧	18	૧૨	19	૧૩	20	૧૪	21
INDIA INDEPENDENCE DAY શ્રાવણ સુદ સાતમ		શ્રી પાર્શ્વનાથ મોક્ષ શ્રાવણ સુદ આઠમ		શ્રાવણ સુદ દસમ		શ્રાવણ સુદ અગ્યારસ		શ્રાવણ સુદ બારસ		શ્રાવણ સુદ તેરસ		શ્રાવણ સુદ ચૌદશ	
૧૫	22	૧	23	૨	24	૩	25	૪	26	૫	27	૬	28
શ્રી મુનિસુવ્રતસ્વામી અવન શ્રાવણ સુદ પૂનમ		શ્રાવણ વદ		શ્રાવણ વદ બીજ		શ્રાવણ વદ ત્રીજ		શ્રાવણ વદ ચોથ		15 DAYS FASTING BEGINS ૧૫ દિવસના ઉપવાસ શરૂ શ્રાવણ વદ પાંચમ		શ્રાવણ વદ છઠ	
૭	29	૮	30	૯	31								
રોહિણી શ્રી ચંદ્રપ્રભસ્વામી મોક્ષ શ્રી શાંતિનાથ અવન શ્રાવણ વદ સાતમ		શ્રી સુપાર્શ્વનાથ અવન શ્રાવણ વદ આઠમ		રોહિણી શ્રાવણ વદ નોમ									

1 MONTH FASTING BEGINS ON THURSDAY, AUGUST 12

૧ મહિનાના ઉપવાસ શરૂ - ગુરુવાર, ઓગસ્ટ ૧૨

15 DAYS FASTING BEGINS FRIDAY, AUGUST 27

૧૫ દિવસના ઉપવાસ શરૂ - શુક્રવાર, ઓગસ્ટ ૨૭

■ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.

■ Please refrain from eating any vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

🧘 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

MONTH	SUNRISE	NAVKASHI	SUNSET
August 1 to 7	5:56am	6:44am	8:04pm
August 8 to 15	6:03am	6:51am	7:54pm
August 16 to 22	6:10am	6:58am	7:44pm
August 23 to 31	6:19am	7:07am	7:30pm

પર્યુષણ પર્વના પાંચ કર્તવ્યો

૧. અમારિ - પ્રવર્તન

અમારિ એટલે અહિંસા, જીવોની હિંસાનો ત્યાગ કરવો. જગતનાં સહુ જીવો પ્રત્યે અત્યંત કરુણા રાખવી અને જીવોને અભયદાન આપવું તથા અપાવવું. ધર્મનું મૂળ દયા - કરુણા રૂપી મૂળનો જ નાશ થઈ જાય તો ધર્મ ટકે જ શી રીતે ?

૨. સાધર્મિક વાત્સલ્ય

સાધર્મિકોની જિનશાસનના ઉપાસક એવા શ્રાવક અને શ્રાવિકાઓની અંતરના બહુમાન સાથે ભકિત કરવી. તેમનું વાત્સલ્ય કરવું. ધન, દોલત વસ્ત્ર, અન્ન, કે રહેઠાણ વગેરે આપીને સહાય કરવી તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય છે. જિનશાસન કહે છે કે એક પલ્લામાં તમામ ધર્મો મૂકો અને બીજા પલ્લામાં સાધર્મિક ભકિત મૂકો તો બન્ને પલ્લાં સરખા થાય.

૩. ક્ષમાપના

જગતના સઘળા જીવો સાથે ક્ષમાપના કરવી. કોઈ પણ જીવ સાથે વૈરભાવ ન રાખવો જો વૈરનો ભાવ દેદયમાં જીવતો રહે તે પછી સાચો ધર્મ આરાધી શકાતો નથી. માટે જ મૈત્રી ભાવને ધારણ કરીને સાચી રીતે ક્ષમા ધર્મની આરાધના કરવી જોઈએ.

૪. અહમ તપ

અહમ એટલે ત્રણ દિવસના ઉપવાસ. આ અહમનો તપ પર્યુષણ નિમિત્તે અવશ્ય કરવો જોઈએ. જીવનમાં લાગેલા પાપોને ધોવા માટે આ તપ કરાવાનો હોય છે. વિષય અને કષાય (કામ- ક્રોધ વગેરે) આત્માનો મેલ છે. તેને દૂર કરવા માટે તપ એ ઉત્તમ સાધુ છે. આ અહમનો તપ ઉપર મુનિવરો નાગકેતુનું ખાસ ઉદાહરણ આપતા હોય છે.

૫. ચૈત્ય પરિપાટી

ચૈત્ય એટલે જિનપ્રતિમા અથવા તો જિનમંદિર. જિનમંદિરોમાં જિનેશ્વર ભગવંતોના દર્શન કરવ જવું તેનું નામ ચૈત્ય પરિપાટી. પરમાત્માનો આપણા ઉપર અસીમ ઉપકાર છે. એમના ઉપકારને અને ગુણોને સદા યાદ કરવા. પૂરા ઠાઠમાઠથી ચૈત્યોના દર્શન વંદન કશ્વા જવું તે શ્રાવકનું મહાન કર્તવ્ય છે. સકળ સંઘની સાથે દર્શન કરવા જવાથી ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ અંતરમાં ઉછળે છે.

FIVE ESSENTIAL DUTIES DURING PARYUSHAN PARVA

1. Jeevdaya – Non Violence

One of the fundamentals of Jainism is compassion and non violence. Avoid hurting any living creature, either by thoughts, words or deeds. This practice is the most basic virtue of being a Jain.

2. Sadharmik Vatsalya - Affection towards fellow Jains

Affection towards fellow Jains Jainism encourages us to not only be kind to all living creatures, but to be understanding of our fellow Jains as each one plays an important role in our faith. We must never prevent other Jains from practicing their faith. Affection towards other Jains, and to all fellow human beings, is among the most important rituals in Jainism

3. Kshamapanaa – Asking for and offering forgiveness

The ritual of Samvatsari Pratikraman, done on the last day of Paryushan, is a must for all Jains. During this ritual, every Jain asks for forgiveness for all the sins that he or she might have committed both knowingly and unknowingly, throughout the past year. Simultaneously, every Jain also pardons others for any deeds that may have hurt them. The ill feelings like anger, lust and revenge defeats the true spirit of Jain faith and Kshamapanaa cleanses us of this negativity.

4. Athum Tap – Fasting for three consecutive days

Every Jain must undertake this three-day fast, normally performed on the last few days of Paryushan Parva. Penance of this kind is a sacrifice of worldly pleasures and allows us to experience how that sacrifice can heighten our spirituality.


5. Chaitya Paripaati – Visit to different Jain Temples

Chaitya means temple. Every Jain must go to temple to worship during Paryushan. Partaking in this religious activity with family, friends, and other Jains means Paripaati. This activity spreads the spirit of our faith and lends increased significance to Paryushan Parva.



|| સકળ સંઘને અંતકરણ પુર્વક મિચ્છામી દુકડમ ||

Avni, Manju & Bharat - Ariya, Jaylen, Devi & Ankit Doshi



SEPTEMBER 2021

શ્રાવણ - ભાદરવો

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
						૧૦ ❖	1	૧૦	2	૧૧	3	૧૨ ❖	4
						શ્રાવણ વદ પ્ર. દસમ		શ્રાવણ વદ દ્વિ. દસમ		PAYRUSHAN MAHAPARVA પર્યુષણ મહાપર્વ શરૂ શ્રાવણ વદ અગ્યારસ		શ્રાવણ વદ બારસ	
૧૪	5	૩૦ ●	6	૧	7	૨	8	૩ ❖	9	૪	10	૫ ❖	11
SWAPNA DARSHAN શ્રાવણ વદ ચૌદશ		LABOR DAY શ્રાવણ વદ અમાસ		ભાદરવા સુદ		ભાદરવા સુદ બીજ		ભાદરવા સુદ ત્રીજ		SAMVATSARI MAHAPARVA સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ ચોથ		STHANAKWASI SAMVATSARI સ્થાનકાવાસી સંવત્સરી ભાદરવા સુદ પાંચમ	
૬	12	૭	13	૮	14	૯	15	૧૦ ❖	16	૧૧	17	૧૨ ❖	18
2021-2022 PATSHSALA ORIENTATION GRANDPARENT'S DAY ભાદરવા સુદ છઠ		ભાદરવા સુદ સાતમ		ભાદરવા સુદ આઠમ		શ્રી સુવિધિનાથ મોક્ષ ભાદરવા સુદ નોમ		ભાદરવા સુદ દસમ		ભાદરવા સુદ અગ્યારસ		ભાદરવા સુદ બારસ	
૧૪	19	૧૫ ○	20	૧	21	૧	22	૨	23	૩	24	૪	25
ભાદરવા સુદ ચૌદશ		ભાદરવા સુદ પૂનમ		ભાદરવા વદ		FIRST DAY OF AUTUMN ભાદરવા વદ દ્વિ. એકમ		ભાદરવા વદ બીજ		ભાદરવા વદ ત્રીજ		ભાદરવા વદ ચોથ	
૫	26	૬	27	૭	28	૮	29	૯	30				
ભાદરવા વદ પાંચમ		રોહિણી ભાદરવા વદ છઠ		ભાદરવા વદ સાતમ		ભાદરવા વદ આઠમ		ભાદરવા વદ નોમ		MONTH September 1 to 7 September 8 to 15 September 16 to 22 September 23 to 30	SUNRISE 6:26am 6:34am 6:41am 6:49am	NAVKASHI 7:14am 7:22am 7:29am 7:37am	SUNSET 7:17pm 7:05pm 6:53pm 6:40pm

PAYRUSHAN MAHAPARVA - FRIDAY, SEPTEMBER 3 - FRIDAY, SEPTEMBER 10

પર્યુષણ મહાપર્વ - શુક્રવાર, સપ્ટેમ્બર ૩ - શુક્રવાર, સપ્ટેમ્બર ૧૦

SAMVATSARI MAHAPARVA - SATURDAY, SEPTEMBER 10

સંવત્સરી મહાપર્વ - શુક્રવાર, સપ્ટેમ્બર ૧૦

■ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી
અને ફળ નો ત્યાગ કરવો.

■ Please refrain from eating any
vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

■ તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

સાંજના પચ્ચકા ં ae

EVENING PACCHKHAANS

pa`harna

pa`har idvscirm>pcckqaim ુpcckqa{Y, AllnT4`awagè > shsagarè > mh | ragarè > svsmaihvi | yagarè > vaesraim ુvaesr [Y.

c]ivharna

idvscirm>pcckqaim ુpcckqa{Y, c]ivhip Aahar > AS` > pa` > qa[m > sa[m > AllnT4` a wagè > shsagarè > mh | ragarè > svsmaihvi | yagarè vaesraim ુvaesr [Y.

itivharna

idvscirm>pcckqaim ુpcckqa{Y, itivhip Aahar > AS` > qa[m > sa[m > AllnT4` awagè > shsagarè > mh | ragarè > svsmaihvi | yagarè > vaesraim ુvaesr [Y.

Aiwghna

Aiwgh>pcckqaim ુpcckqa{Y, AllnT4` awagè > shsagarè > mh | ragarè > svsmaihvi | yagarè > vaesraim ુvaesr [Y.

divharna

idvscirm pcckqaim ુpcckqa{Y, divhip Aahar > AS` > qa[m > AllnT4` awagè > shsagarè > mh | ragarè > svsmaihvi | yagarè > vaesraim ુvaesr [Y.

dsavgaisA

dsavgaisA>]vwag>pirwag>pcckqaim ુpcckqa{Y, AllnT4` awagè > shsagarè > mh | ragarè > svsmaihvi | yagarè > vaesraim ુvaesr [Y.

sdna: drk pcckqa`ma>svy>paeani mdekrti vqtekrnare`pcckqaim Anevaesraim` baevu t4a bl=nekravti vqte`pcckqa{ Anevaesr [” baevu

Paanhaar:

Paanhaar divascharim, pacchkhaami (pacchkhai), annathanaa-bhogenum, sahasaa-gaarennum, mahattaraagaarennum, savva-samahi-vattiyaagaarennum, vosiraami (vosirai).

Chauvihaar:

Divascharim pacchkhaami (pacchkhai), chauvihumpi aahaarum, asanum, paanum, khaaimum, saaimum, annathanaa-bhogenum, sahasaa-gaarennum, mahattaraagaarennum, savva-samahi-vattiyaagaarennum, vosiraami (vosirai).

Tivihaar:

Divascharim pacchkhaami (pacchkhai), tivihumpi aahaarum, asanum, paanum, khaaimum, saaimum, annathanaa-bhogenum, sahasaa-gaarennum, mahattaraagaarennum, savva-samahi-vattiyaagaarennum, vosiraami (vosirai).

Duvihaar:

Divascharim pacchkhaami (pacchkhai), duvihumpi aahaarum, asanum, paanum, khaaimum, annathanaa-bhogenum, sahasaa-gaarennum, mahattaraagaarennum, savva-samahi-vattiyaagaarennum, vosiraami (vosirai).

Note:

When taking any pacchkhaan for one's own sake, say the word pacchkhaami and vosiraami. When giving the pacchkhaan to someone else say the word pacchkhai and vosirai. The acceptor of the pacchkhaan will then say the word pacchkhaami and vosirami respectively.


** This pacchkhaan is taken before drinking water on the second morning when one has taken the pacchkhaan of Chattha (2 Upvaas together) on the first day. This is repeated on the third day when one has taken the pacchkhaan of Atthum (3 Upvaas together).

IMPORTANT

For correct pronunciations of the above pacchkhaans, kindly consult someone who can read and recite them in Gujarati.



In Loving Memory of our Daughter Purvi Shah
Pallavi, Satish, Arpi, Shail, Kaiyan & Rohan Shah



OCTOBER 2021

ભાદરવો - આસો

વીર સંવત ૨૫૪૭ • વિક્રમ સંવત ૨૦૭૭

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT		
૧૦	31	MONTH Oct. 01 to 07 6:56am 7:44am 6:28pm Oct. 08 to 15 7:05am 7:53am 6:15pm Oct. 16 to 22 7:12am 8:00am 6:05pm Oct. 23 to 31 7:23am 8:11am 5:52pm								૧૦	1	૧૧	2		
આસો વદ દસમ										ભાદરવા વદ દસમ		ભાદરવા વદ અગ્યારસ			
૧૨	3	૧૩	4	૧૪	5	૩૦	●	6	૧	7	૨	8	૩	9	
PATHSHALA						શ્રી નેમિનાથ કેવલ		ભાદરવા વદ અમાસ		આસો સુદ		આસો સુદ બીજ		આસો સુદ ત્રીજ	
ભાદરવા વદ બારસ		ભાદરવા વદ તેરસ		ભાદરવા વદ ચૌદશ											
૫	10	૬	11	૭	12	૮	13	૯	14	૧૦	15	૧૧	16		
		COLUMBUS DAY		આયંબિલની ઓળી શરૂ											
આસો સુદ પાંચમ		આસો સુદ છઠ		આસો સુદ સાતમ		આસો સુદ આઠમ		આસો સુદ નોમ		આસો સુદ દસમ		આસો સુદ અગ્યારસ			
૧૨	17	૧૩	18	૧૪	19	૧૫	○	20	૧	21	૨	22	૩	23	
PATHSHALA						શ્રી નમિનાથ અવન		આસો સુદ પૂનમ		આસો વદ		આસો વદ બીજ		આસો વદ ત્રીજ	
આસો સુદ બારસ		આસો સુદ તેરસ		આસો સુદ ચૌદશ											
૪	24	૪	25	૫	26	૬	27	૭	28	૮	29	૯	30		
રોહિણી				શ્રી સંભવનાથ કેવલ											
આસો વદ પ્ર.ચોથ		આસો વદ દ્વિ.ચોથ		આસો વદ પાંચમ		આસો વદ છઠ		આસો વદ સાતમ		આસો વદ આઠમ		આસો વદ નોમ			

AAYAMBIL OLI - TUESDAY, OCTOBER, 12 - WEDNESDAY, OCTOBER, 20

આયંબિલની ઓળી - મંગળવાર, ઓક્ટોબર ૧૨ - બુધવાર, ઓક્ટોબર ૨૦

■ સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.

■ Please refrain from eating any vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

🙏 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

ચોઘડિયા

દિવસના ચોઘડિયા

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ	શુભ	ચલ	કાળ
ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ	શુભ
લાભ	શુભ	ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ
અમૃત	રોગ	લાભ	શુભ	ચલ	કાળ	ઉદ્દેગ
કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ	શુભ	ચલ
શુભ	ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ
રોગ	લાભ	શુભ	ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત
ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ	શુભ	ચલ	કાળ

રાત્રિના ચોઘડિયા

શુભ	ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ
અમૃત	રોગ	લાભ	શુભ	ચલ	કાળ	ઉદ્દેગ
ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ	શુભ
રોગ	લાભ	શુભ	ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત
કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ	શુભ	ચલ
લાભ	શુભ	ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ
ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ	શુભ	ચલ	કાળ
શુભ	ચલ	કાળ	ઉદ્દેગ	અમૃત	રોગ	લાભ

Pakhi /Chaumasi Pratikraman

MONTH	DATE
Nov. 2020	14
Nov. 2020	29
Dec. 2020	13
Dec. 2020	29
Jan. 2021	12
Jan. 2021	27
Feb. 2021	10
Feb. 2021	26
Mar. 2021	12
Mar. 2021	27

MONTH	DATE
Apr. 2021	11
Apr. 2021	26
May 2021	10
May 2021	25
Jun. 2021	09
Jun. 2021	23
Jul. 2021	09
Jul. 2021	23
Aug. 2021	07
Aug. 2021	21

MONTH	DATE
Sep. 2021	05
Sep. 2021	19
Oct. 2021	05
Oct. 2021	19
Nov. 2021	03
Nov. 2021	18
Dec 2021	03
Dec. 2021	18

Chaumasi Pratikraman

CHOGHADIYAA

Day Time Choghadiyaa

Sun	Mon	Tues	Wed	Thurs	Fri	Sat
Udweg	Amrut	Rog	Laabh	Shoobh	Chul	kaal
Chul	Kaal	Udweg	Amrut	Rog	Laabh	Shoobh
Laabh	Shoobh	Chal	Kaal	Udweg	Amrut	Rog
Amrut	Rog	Laabh	Shoobh	Chul	Kaal	Udweg
Kaal	Udweg	Amrut	Rog	Laabh	Shoobh	Chul
Shoobh	Chul	Kaal	Udweg	Amrut	Rog	Laabh
Rog	Laabh	Shoobh	Chul	Kaal	Udweg	Amrut
Udweg	Amrut	Rog	Laabh	Shoobh	Chul	Kaal

Night Time Choghadiyaa

Shoobh	Chul	Kaal	Udweg	Amrut	Rog	Laabh
Amrut	Rog	Laabh	Shoobh	Chul	Kaal	Udweg
Chul	Kaal	Udweg	Amrut	Rog	Laabh	Shoobh
Rog	Laabh	Shoobh	Chul	Kaal	Udweg	Amrut
Kaal	Udweg	Amrut	Rog	Laabh	Shoobh	Chul
Laabh	Shoobh	Chul	Kaal	Udweg	Amrut	Rog
Udweg	Amrut	Rog	Laabh	Shoobh	Chul	Kaal
Shoobh	Chul	Kaal	Udweg	Amrut	Rog	Laabh


સમજણ : ચોઘડીયાં જોવાની રીતમાં કેટલાક જાણસુઓ ૧૨ કલ્લાકના સરખા આઠ ભાગ કરી ચોઘડીયાં જુએ છે. એટલે તેઓ ૧૧ા ૧૧ા કલ્લાકનું દરેક ચોઘડીયુ હોય એમ સમજે છે. પણ ખરી વાત એ છે કે સુર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો અને સૂર્યાસ્તથી બીજા દિવસના સુર્યોદય સુધીના એક સરખા આઠ આઠ ભાગ કરી તે પ્રમાણે આઠ ચોઘડીયાં જોવાના હોય છે. ચોઘડીયાં સમય એક સરખો નથી હોતો. સુર્યોદય અને સૂર્યાસ્ત ઓછો વત્તો થાય છે. જે રીતે દિવસનાં ચોઘડીયાં જોવાય છે, તે જ રીતે રાત્રિનાં ચોઘડીયાં જોવા. આટલું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

લાલ અક્ષરવાળા ચોઘડીયાં સારા જાણવા.

DETERMINING CHOGHADIYAAS OR TIME SEGMENTS: The simplest way of determining the duration of the choghadiyaa is to divide the time between the sunrise and sunset of that day into eight equal time periods. Then correspond the desired choghadiyaa from the chart and add the number of time periods to the sunrise time in a progressive manner.

For determining the choghadiyaas of the night, divide the time interval between the sunset and sunrise time of the next day into eight equal periods. Then follow the same procedures as explained earlier but add the time segments to the sunset time progressively.

Red denotes Auspicious Choghadiyaa



॥ જૈનમ જયતિ શાસનમ ॥ ॥ સર્વજીવ કરુ શાસન રસી ॥
In Loving Memory of our Parents Late Dr. Vasant P. Shah & Late Jayshree V. Shah
Mihika, Ishan, Dharini & Kunjal Shah





Jainam Jayati Shashanam!

JAIN SANGH OF CHERRY HILL

પંચાગમાં જિનઆજ્ઞા વિરુદ્ધ કાંઈપણ છપાયું હોય તે માટે મન, વચન અને કાયાથી મિચ્છામી દુકકડમ્

We ask for forgiveness for any material printed in this panchaang that may unintentionally go against the teaching of Tirthankar Bhagwaan

References

1. Panchaang started by Acharya Shri Vijay Pratapsurishwarji & at present created by Acharya Shri Vijay Kanakratnasurishwarji
2. Vividh Vidhi Sanghrahaha by Muni Amrendrasagarji
3. Dr. Kumarpal Desai (Amdavad)
4. Tatva Gyan Praveshika by Dhananjay J. Jain

Arranged & Compiled by Nilesh Jhaveri (908) 240-7375

Designed by Printmediaonline - 732-993-5043

mkyupa05nl rlt-irvaj

hm` a>hm` a>Aap` a j Baaam&ek UmDdaY nel [j ta>J&erael j & "ram ba&aeva[ram", ba&et&, "– nma&Airh&ta` >, "smraem&nl 2b"
 A4va "Airh&extr` epvJ=im" vgeeba&evanl prpra x½ 4ye 0e t&A&nr` p` 6` a> ak&ekrva ma&ya 0e p` j B2mRl zI` v3wrl „i*3Ae=ka>
 A9rnl Aaxatna n 4ay ma3&Aav&ka& p` ba&evan& ½r n4l. ma& p` &j van&ya& 0e mnma>nv&karm& g` l x&ay 0e vgr ba&essarnl AinTyta
 ivcarl x&ay. v&E&y 4vana&ep&ag Aana4l v2ubl=&kyam5l x&ke A&ya&Imm&ag&aeivcar krva4l 6` um&vl x&ay t&e&e.....rIn&yl]pasna



॥ મીતીમે સવ્વ ભુએસુ, વેરંમ મજ્જં ન કેણાઈ ॥

What do you gain by Prayer, Best answer given by Swami Vivekanand

“I gained nothing, In Fact I Lost Anger, Depression, Jealousy, Irritation & Insecurity.”

Rasila Vinodkumar Shah • Shah Anand & Rujuta - Shah Preeti & Neeraj



DECEMBER 2021

કારતક - માગશર

વીર સંવત ૨૫૪૮ • વિક્રમ સંવત ૨૦૭૮

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT
		MONTH December 1 to 7 7:04am 7:52am 4:26pm December 8 to 15 7:11am 7:59am 4:26pm December 16 to 22 7:15am 8:03am 4:27pm December 23 to 31 7:18am 8:06am 4:30pm				૧૨ ❖	1	૧૩	2	૧૪	3	૩૦ ●	4
						કારતક વદ બારસ		કારતક વદ તેરસ		કારતક વદ ચૌદશ		VIRTUAL SNATRA PUJA	
૨	5	૩	6	૪	7	૫	8	૬	9	૭	10	૮	11
PATHSHALA						માગશર સુદ પાંચમ		માગશર સુદ છઠ		માગશર સુદ સાતમ		માગશર સુદ આઠમ	
૯	12	૧૦	13	૧૧	14	૧૨	15	૧૩	16	૧૩	17	૧૪	18
માગશર સુદ નોમ		માગશર સુદ દસમ		માગશર સુદ અગ્યારસ		માગશર સુદ બારસ		માગશર સુદ પ્ર. તેરસ		માગશર સુદ દ્વિ. તેરસ		માગશર સુદ ચૌદશ	
૧૫ ○	19	૧	20	૨	21	૩	22	૪	23	૫	24	૬	25
PATHSHALA				FIRST DAY OF WINTER		માગશર વદ ત્રીજ		માગશર વદ ચોથ		માગશર વદ પાંચમ		માગશર વદ છઠ	
માગશર સુદ પૂનમ		માગશર વદ		માગશર વદ બીજ		માગશર વદ ત્રીજ		માગશર વદ ચોથ		માગશર વદ પાંચમ		માગશર વદ છઠ	
૭	26	૮	27	૯	28	૧૦	29	૧૧	30	૧૨	31		
માગશર વદ સાતમ		માગશર વદ આઠમ		માગશર વદ નોમ		માગશર વદ દસમ		માગશર વદ અગ્યારસ		માગશર વદ બારસ			

MAUN AGYAARUS - TUESDAY, DECEMBER 14

મૌન અગ્યારસ - મંગળવાર, ડિસેમ્બર ૧૪, માગશર સુદ ૧૧ - પાંચ કલ્યાણકો
 શ્રી અરનાથ દીક્ષા, શ્રી મલ્લિનાથ જન્મ, શ્રી મલ્લિનાથ દીક્ષા, શ્રી મલ્લિનાથ કેવલ, શ્રી નમિનાથ કેવલ

- સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો.
- Please refrain from eating any vegetables and fruits on this day

❖ Auspicious Days

❖ શુભ દિવસો

🙏 તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

Jain Pathshaha

Continuing the 30 year tradition of Pathshala at our temple, we have 25 teachers teaching about 70 children various aspects of Jain Philosophy, Sutras and Languages. Here are the details of the various classes. Our Pathshala uses the books created by JAINA Education Committee for the curriculum.

Philosophy Classes and Teachers:

3-4 yrs class: Rupal Patel, Yagna Veda, Ruchi Palvia
5-7 yrs class: Swetha Chedda, Nehal Shah, Krima Shah
8-10 yrs class: Kruti Kapadia, Vaishakhi Shah, Jolly Desai
11-13 yrs class: Komal Gandhi, Namrata Shah, Divya Lodaya
14+ yrs class: Mulchand Gala, Hetal Shah

Sutra classes and Teachers:

2-4 yrs: Shraddha Jain, Aarti Sanchetti
5-7 yrs: Nehal Shah, Aksha Desai
8-10 yrs: Jasmita Shah, Vaishali Sanghvi
11+ yrs: Pinky Patwa, Vaishali Shah

Language classes and Teachers:

Gujarati Junior : Prashant Patel, Mihir Shah
Gujarati Senior : Biren Gandhi, Jinesh Gandhi
Hindi : Shraddha Jain, Aarti Sanchetti

This school year we have virtual classes every Sunday from 10:30 AM till noon ET:

1st and 3rd Sunday: philosophy classes
2nd and 4th Sunday : Language and Sutra classes

If you would like to register your child for Pathshala, please visit <https://www.jainsangh.org/pathshala/>

જૈન પાઠશાળા

આપણા દેરાસર ની 30 વર્ષની પરંપરાને ચાલુ રાખતા, પાઠશાળામાં 25 શિક્ષકો 70 બાળકોને જૈન તત્ત્વજ્ઞાન, સૂત્રો અને ભાષાઓ શીખવે છે. વિવિધ વર્ગોની વિગતો અહીં આપી છે. આપણી પાઠશાળા અભ્યાસક્રમ માટે જૈના એજ્યુકેશન કમિટી દ્વારા રચિત પુસ્તકોનો ઉપયોગ કરે છે.

તત્ત્વજ્ઞાન નાં વર્ગો અને શિક્ષકો:

2-4 વર્ષ નો વર્ગ : રૂપલ પટેલ, યજ્ઞા શાહ, રૂચી પાલવીયા
5-7 વર્ષનો વર્ગ: શ્વેતા છેડા, નેહલ શાહ, ક્રિમા શાહ
8-10 વર્ષ વર્ગ: ક્રુતિ કાપડિયા, વૈશાખી શાહ, જોલી દેસાઈ
11-13 વર્ષ વર્ગ: કોમલ ગાંધી, નમ્રતા શાહ, દિવ્યા લોદય
14+ વર્ષ વર્ગ: મૂલચંદ ગાલા, હેતલ શાહ

સૂત્ર નાં વર્ગો અને શિક્ષકો:

2-4 વર્ષ: શ્રદ્ધા જૈન, આરતી સંચેતી
7-7 વર્ષ: નેહલ શાહ, આક્ષા દેસાઈ
8-10 વર્ષ: જસ્મિતા શાહ, વૈશાલી સંઘવી
11+ વર્ષ: પિંકી પટવા, વૈશાલી શાહ

ભાષા વર્ગો અને શિક્ષકો:

ગુજરાતી પ્રારંભિક : પ્રશાંત પટેલ, મિહિર શાહ
ગુજરાતી વરિષ્ઠ : બિરેન ગાંધી, જિનેશ ગાંધી
હિન્દી: શ્રદ્ધા જૈન, આરતી સંચેતી

આ શાળા વર્ષ વર્ગો ઓનલાઇન દર રવિવારે સવારે 10:30 વાગ્યાથી બપોર સુધી ET રાખેલ છે :

1લો અને 3જો રવિવાર: ફિલસૂફી નાં વર્ગો
2જો અને 4થો રવિવાર: ભાષા અને સૂત્ર નાં વર્ગો

જો તમે પાઠશાળા માટે તમારા બાળકની નોંધણી કરવા માંગતા હો, તો કૃપા કરીને <https://www.jainsangh.org/pathshala/> ની મુલાકાત લો.

શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવંતુ ભૂતગણાઃ દોષાઃ પ્રાયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ
સર્વમંગલ માંગલ્યં, સર્વકલ્યાણ કારણમ્, પ્રધાનં સર્વધર્માણાં, જૈનમ્ જયતિ શાસનમ્

JANUARY 2022

માગશર - પોષ

વીર સંવત ૨૫૪૮ • વિક્રમ સંવત ૨૦૭૮

રવિ	SUN	સોમ	MON	મંગળ	TUE	બુધ	WED	ગુરુ	THUR	શુક્ર	FRI	શનિ	SAT	
૧૩	30	૧૪	31									૧૪	1	
પોષ વદ તેરસ		પોષ વદ ચૌદશ												
૩૦	●	2	૧	3	૨	4	૩	5	૪	6	૫	7	૬	8
માગશર વદ અમાસ		પોષ સુદ	પોષ સુદ બીજ	પોષ સુદ ત્રીજ	પોષ સુદ ચોથ	પોષ સુદ પાંચમ	પોષ સુદ છઠ							
૭	9	૮	10	૯	11	૧૦	12	૧૧	13	૧૨	14	૧૩	15	
પોષ સુદ સાતમ		પોષ સુદ આઠમ	પોષ સુદ નોમ	પોષ સુદ દસમ	પોષ સુદ અગ્યારસ	પોષ સુદ બારસ	પોષ સુદ તેરસ							
૧૪	16	૧૫	○	17	૧	18	૧	19	૨	20	૩	21	૪	22
પોષ સુદ ચૌદશ		MARTIN L. KING JR. DAY પોષ સુદ પૂનમ	પોષ વદ	પોષ વદ દ્વિ.એકમ	પોષ વદ બીજ	પોષ વદ ત્રીજ	પોષ વદ ચોથ							
૫	23	૬	24	૮	25	૯	26	૧૦	27	૧૧	28	૧૨	29	
રોહિણી શ્રી અજિતનાથ કેવલ પોષ વદ પાંચમ		પોષ વદ છઠ	પોષ વદ આઠમ	INDIA - REPUBLIC DAY શ્રી અભિનંદનસ્વામી કેવલ પોષ વદ નોમ	શ્રી ધર્મનાથ કેવલ પોષ વદ દસમ	પોષ વદ અગ્યારસ	પોષ વદ અગ્યારસ							
								<input type="checkbox"/> સર્વ પ્રકારની લીલોતરી, શાકભાજી અને ફળ નો ત્યાગ કરવો. <input type="checkbox"/> Please refrain from eating any vegetables and fruits on this day				<input checked="" type="checkbox"/> Auspicious Days <input checked="" type="checkbox"/> શુભ દિવસો <input checked="" type="checkbox"/> તીર્થંકર ભગવંતોના કલ્યાણકો		



JAIN SANGH OF CHERRY HILL



3401 Cooper Avenue (Corner of Cooper & Park Avenue), Pennsauken TWP, NJ 08109
(856) 662-1076 • web: www.jainsangh.org

Directions to the Temple:

1. From New Jersey Turnpike: Exit 4, to Rt. 73 North. Go 4 miles. Take Jughandle at High St. Take first right at Fork Landing Rd, First left at Park Ave. To Derasar, 1.5 miles on left.
2. From Rt. 295 Southbound: Exit 36 B. Follow directions From New Jersey Turnpike.
3. From Rt. 295 Northbound: Exit 34 B. to Rt. 70 West, go 2.5 miles, turn Right at Rt. 644 North, Haddonfield Rd. Go 3 miles to Park Ave, turn left. To Derasar, 1 mile on left.
4. From Betsy Ross Bridge (Easiest & Fastest Route): Rt. 90 East, to Rt., 644 South, Haddonfield Rd., Haddonfield/Cherry Hill Exit. Turn right at 2nd light, Park Ave. TO Derasar, 1 mile on left.
5. From Tacony-Palmyra Bridge: Rt. 73 South. Go 2 miles. Take Rt. 644 South, Haddonfield Rd., Haddonfield Exit. Tum right at 3rd light, Park Ave. To Derasar, 1 mile on left.
6. From Ben Franklin Bridge: Rt. 30 East, to Rt. 130 North. Go 2.5 miles. Turn right on Cove Rd. (Traffic light & Subway). Turn left at Park Ave. To Derasar on right after Railroad.
7. From AC Express Way: Take Rt. 42 North. Take Exit Rt. 130 North, Go 6 Miles, Turn right on Cove Rd. (Traffic light and Subway). Turn left at Park Ave. To Derasar on right after Railroad.